

તांत्रिक पुस्तिका-५

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના  
“સર્વે એન્ડ સર્વેલન્સ બેઈજીડી પેસ્ટ એન્ડ ડીસીઝ ફોરવોનીંગ સીસ્ટમ  
ફોર સાઉથ ગુજરાત”  
અંતર્ગત

## મોજણી અને નિગાહ આધારિત આંબા અને ચીકુની જીવાત-રોગ પૂર્વનુભાન પદ્ધતિ



તાલીમ મેન્યુઆલ  
૨૦૦૬



કૃટકશાસ્ત્ર વિભાગ  
ન.મ. કૃષિ મહાવિદ્યાલય  
નવસારી કૃષિ ચુનિવર્સિટી  
નવસારી-૩૬૬ ૪૫૦





૧.૧ અંબાના થડ પર  
મધિયાના પુષ્ટ કીટકો સુખુમ અવસ્થામાં



૧.૨ અંબાના થડ પર મધિયાના પુષ્ટ કીટકો



૧.૩ મધિયાના પુષ્ટ કીટકો

**રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના**  
**"સર્વે એન્ડ સર્વેલન્સ બેઝડ પેસ્ટ એન્ડ ડીસીજ ફોરવોર્નિંગ સીસ્ટમ ફોર  
સાઉથ ગુજરાત"**

**અંતર્ગત**

**મોજણી અને નિગાહ આધારિત આંબા અને ચીકુની જીવાત-રોગ  
પૂર્વાનુમાન પદ્ધતિ**

**તાલીમ મેન્યુઅલ  
૨૦૦૯**



**ક્રીટકશાસ્ત્ર વિભાગ  
ન.મ. કૃષિ મહાવિદ્યાલય  
નવસારી કૃષિ યુનિવર્સિટી  
નવસારી-૩૮૬ ૪૫૦**

**રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના**  
"સર્વે એન્ડ સર્વેલન્સ બેઝડ પેસ્ટ એન્ડ ડીસીઝ ફોરવોનીંગ સીસ્ટમ ફોર  
સાઉથ ગુજરાત"

અંતર્ગત

**મોજણી અને નિગાહ આધારિત આંબા અને ચીકુની જીવાત-રોગ  
પૂર્વાનુમાન પદ્ધતિ**

**તાલીમ મેન્યુઅલ**  
**૨૦૦૯**

**ડૉ. જી. જી. રાણ્દિયા  
ડૉ. એચ. વી. પંડ્યા  
ડૉ. એમ. બી. પટેલ  
ડૉ. એમ. એસ. પુરોહિત**



**ક્રીટકશાસ્ત્ર વિભાગ  
ન.મ. કૃષિ મહાવિદ્યાલય  
નવસારી કૃષિ યુનિવર્સિટી  
નવસારી-૩૮૮ ૪૫૦**

## કવર પેઇઝ ફોટોગ્રાફ:

મુદ્દણ : માર્ચ-૨૦૦૬  
નકલ: ૨૦૦૦

### પ્રકાશક :

પ્રાધ્યાપક અને વડા  
કીટકશાસ્ત્ર વિભાગ  
ન.મ. કૃષિ મહાવિદ્યાલય  
નવસારી કૃષિ યુનિવર્સિટી  
નવસારી-ઉદ્દ ૪૫૦  
ગુજરાત  
ફોન નંબર: (૦૨૬૩૭) ૨૮૨૭૭૧-૭૭૫ (એક્સ ઉ૦૭)

મદ્રાસા  
અધ્યક્ષ ગ્રાહીકાર,  
જૈન સોસાયટી, કુવારા પાસે,  
નવસારી-ઉદ્દ ૪૫૦  
ફોન નં. (૦૨૬૩૭) ૨૫૬૬૪૫

જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, કીટકશાસ્ત્ર વિભાગ, ન.મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી ખાતે  
ખેતી પાડોમાં નુકશાન કરતા કીટકોના જૈવિક નિયંત્રણ માટે ટાયકોગ્રામા ચીલીનીસના ટાયકોકાર્ડ તેમજ  
કાયસોપલાર્સ કાર્નિયાના કાયસોપલાર્સ કાર્ડ તેથાર કરવામાં આવે છે. સદર કાર્ડનું વેચાણ વ્યાજબી ભાવે કરવામાં  
આવતું હોવાથી આ અંગે ફોનથી અથવા રૂબરૂમાં સંપર્ક કરવો.



ડૉ. આર. પી. ઓસ. અહલાવત  
કુલપતિ  
નવસારી કૃષિ યુનિવર્સિટી  
નવસારી.

### આમુખ

આંબા-ચીકુના પાકમાં જીવાતો, રોગો તથા હવામાન પાક ઉત્પાદન માટે અગત્યના પરિબળો છે. પાક જીવાતના સંકલિત નિયંત્રણ માટે જે તે પાકમાં જીવાતનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા કરતાં વધુ જોવા મળે તારે જ પાક સંરક્ષાગુણની જુદી જુદી પદ્ધતિઓ પેકી યોગ્ય પદ્ધતિની પસંદગી કરી જીવાત નિયંત્રણ માટે પગલાં હાથ ધરવા સતત મોજાગુણી અને નિગાહ કરતી રહેવી ખૂબ જ આવશ્યક છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ડેફન્ડ ક્રીટકશાસ્ક વિભાગ ખાતે ચાહતી “સર્વેઅન્ડ સર્વેલન્સ બેઇઝ્ડ પેસ્ટ અન્ડ રીસીઝ ફોરવોન્નિંગ સીસ્ટમ ફોર સાઉથ ગુજરાત” અંતર્ગત દક્ષિણ ગુજરાતના મુખ્ય પાકોમાં આવતી જીવાતોની વસ્તીમાં થતા ફેરફારની સતત મોજાગુણી કરવી તથા તેના આધારે જે તે પાકમાં કોઈ પાણું જીવાતનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા કરતાં વધુ જોવા મળે તો તાત્કાલિક બેદૂતોને આ જીવાતોના નિયંત્રણ માટે હાથ ધરવાના પગલાં ઓની માહિતી દૂરદર્શન, આકાશવાગુણી, સમાચારપત્રો કે યુનિવર્સિટીના જુદા જુદા ૧૮ કેન્દ્રો પરથી આપવાની ગોઠવાગુણ કરવામાં આવેલ છે. દક્ષિણ ગુજરાતને ફળોના નિકાસ માટે એચી એક્ષપોર્ટ ઓન જાહેર કરેલ છે. તારે આ યોજના અંતર્ગત જીવાતો તથા રોગોના ઉપદ્રવની માહિતી અગમચેતી રૂપે બેદૂતોને મળતાં સમયસરના પાક સંરક્ષાગુણા પગલાં લઈ શકશે. આશા રાખું છું કે ક્રીટકશાસ્ક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ આંબા-ચીકુની જીવાતો અને રોગો અંગેની તાલીમ મેન્યુઅલ સંશોધનકાર્યક્રમ, વિસ્તરાગ કાર્યક્રમ, આ કાર્યક્રમ સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ, અધિકારીઓ તથા બેદૂત મિત્રોને તાલીમ દરમાન તેમજ યોજનાના અમલ દરમાન પાક જીવાત-રોગ પૂર્વનુમાન પદ્ધતિના અવલોકનો લેવા માટે માર્ગદર્શક પુરવાર યશે. આ તાલીમ મેન્યુઅલમાં આપવામાં આવેલી અમૂલ્ય માહિતીનો ઉપયોગ કરી બેદૂતોને સમયસર પાક જીવાત નિયંત્રણ માટે સાવધ કરવામાં આવશે જે કૃષિ ઉત્પાદન વધારવામાં ઉપયોગી યશે. આ તાલીમ મેન્યુઅલ તૈયાર કરવા માટે ડૉ. જી. રાદહિયા, ડૉ. એચ. વી. પંડ્યા, ડૉ. એમ. બી. પટેલ, ડૉ. એમ. એસ. પુરોહિત અને ડૉ. એ. એન. સાબલપરાને અભિનંદન પાઠવું છું.

(ાર. પી. ઓસ. અહલાવત)  
કુલપતિ

તારીખ : ૩૦-૩-૦૮  
સ્થળ : નવસારી



ડૉ. સી. પટેલ  
આચાર્ય  
ન. મ. કૃપિ મહાવિદ્યાલય  
નવસારી કૃપિ યુનિવર્સિટી  
નવસારી.

## શુભેચ્છા સંદેશ

દક્ષિણ ગુજરાતમાં ફળપાકોના વાવેતર પૈકી આંબા અને ચીકુના પાકનું વાવેતર ખૂબ જ મોટા વિસ્તારમાં કરવામાં આવે છે. આ પાકોમાં જીવાત-રોગના ઉપદ્રવને કારણે ધારું જ આર્થિક નુકશાન ખેડૂતોએ વેઠું પડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કેરીની નિકાસ પાણ વધેલ છે. આ પરિસ્થિતિમાં સદર પાકોમાં આવતા જીવાત-રોગનું સતત મોનીટરીંગ કરી તેમજ સાથે સાથે હવામાનની જીવાત-રોગ પર થતી અસરોનો વ્યવસ્થિત અભ્યાસ કરી ખેડૂતોને અગાઉથી જ જીવાતોના નિયંત્રણ માટે સાવધાન કરી યોગ્ય માર્ગદર્શન આપી જીવાત-રોગથી થતા નુકશાનથી બચાવી શકાય છે. આ હેતુ માટે અત્રેના કીટકશાસ્ત્ર વિભાગ તરફથી આંબા ચીકુના પાકમાં જીવાત-રોગ પૂર્વનુમાન પદ્ધતિની એક તાલીમ મેન્યુઅલ તેયાર કરવામાં આવેલ છે. તેમાં દરેક જીવાત તથા રોગ વિષેની સંપૂર્ણ માહિતી કલર ફોટોગ્રાફ સાથે આપેલ છે. ખરેખર આ તાલીમ મેન્યુઅલ દરેકને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. આ કાર્યક્રમ સરકણ થાય અને તેના આધારે કંઈક ઉપયોગી તારાણો નીકળી આવે તેવી અપેક્ષા સાથે શુભેચ્છા પાઠવું છું.

S. Patel

(સી. પટેલ)  
આચાર્ય

તારીખ : 30-3-05

સ્થળ : નવસારી

## અનુકૂળપત્ર

અનુ.નં.	વિગત	પાન નંબર
1.	આંબાની જીવાતો	૧
1.1	મધિયો	૧
1.2	શ્રીસ	૩
1.3	ફળ માખી	૪
1.4	મેડ	૮
1.5	ચીકટો	૯
1.6	ગોટલાનું ચાંચવું	૧૦
1.7	ઝૂખ વેઘ/મોરની ઝૂખ કોરી આનાર ઈયળ	૧૧
1.8	ઉધાઈ	૧૨
1.9	રાતી કીડી	૧૨
1.૧૦	ગાંઢીયા માખી	૧૩
2.	ચીકુની જીવાતો	૧૪
2.1	કણી કોરનાર ઈયળ	૧૪
2.2	ચીકુ મોથ	૧૬
2.3	પાનની મધ્યનસથી ધાર વાળનાર ઈયળ	૧૭
2.4	પાન કોરીયું	૧૮
2.5	ફળમાખી	૧૯
2.6	બીજ કોરીઆનાર ઈયળ	૧૯
2.7	ઘોડીયા ઈયળ	૧૯
2.8	કાતરા	૨૦
2.૯	અન્ય જીવાતો	૨૦
3.	આંબાના રોગો	૨૧
3.1	ભૂષી છારો	૨૧
3.2	કાલબણ/કાળયો	૨૩
3.3	વિકૃતિ	૨૪
3.૪	અવરોહ મૂત્યુ	૨૭
3.૫	કાળી ડાળિના રોગ	૨૮
3.૬	શ્વામ છારો	૨૯
3.૭	પાનનો ભૂખરો જાળ	૩૦
3.૮	પાનની ટોચનો જાળ	૩૦
3.૯	તાખ ગેડુ	૩૧
3.૧૦	વાંદો	૩૨
૪.	ચીકુના રોગો	૩૩
૪.૧	પાનનો ટપકાંનો રોગ	૩૩
૪.૨	સુકારો	૩૪
૪.૩	શ્વામ છારો	૩૬
૪.૪	વાંદો	૩૭
૫.	પાન જીવાત રોગ કોડ નંબર	૩૮
૬.	Observation sheet	૪૩

## પ્રસ્તાવના

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત અત્રેના વિભાગ ખાતે “સર્વ એન્ડ સર્વેલન્સ બેઇઝડ પેસ્ટ એન્ડ ડિસ્ટ્રિક્શન ફોર્મોનીંગ સીસ્ટમ ફોર સાઉથ ગુજરાત” અંતર્ગત દક્ષિણ ગુજરાતના મુખ્ય પાકોમાં આવતી જીવાતોની વસ્તીમાં થતાં ફેરફારની સતત મોજાળું કરવી તથા તેના આધારે જે તે પાકમાં કોઈ પાણ જીવાતનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા કરતાં વધુ જોવા મળે તો તાત્કાલિક ખેડૂતોને આ જીવાતોના નિયંત્રણ માટે હાથ ધરવાના પગલાં ઓની માહિતી દૂર્દર્શન, આકાશવાગી, સમાચારપત્રો કે યુનિવર્સિટીના જુદા જુદા ૧૮ કેન્દ્રો પરથી આપવાની ગોઠવાગ કરવામાં આવેલ છે.

આ તાલીમ મેન્યુઅલમાં આંબા-ચીકુના પાકોમાં આવતી મુખ્ય જીવાતો અને રોગોને આવરી લીધેલ છે જેમાં જીવાતો તથા રોગોની ઓળખ, નુકશાન, અવલોકન પદ્ધતિ અને નિયંત્રણ વ્યવસ્થાપન અંગેની માહિતી સરળ ભાષામાં આપવામાં આવેલ છે. અવલોકન લેનાર ક્રમચારી પોતાનો અહેવાલ ખૂબ જ ટૂંકા સમયમાં તૈયાર કરી શકે તે માટે કેન્દ્ર, તાલુકા, જિલ્લા, પાક, જાત અને જીવાતના કોડ આપવામાં આવેલ છે. જેનાથી ખૂબ જ ઓછા સમયમાં અહેવાલ તૈયાર કરી શકાશે. આશા છે કે તાલીમ મેન્યુઅલનો વ્યવસ્થિત અભ્યાસ કરવાથી અવલોકનની સાતત્યતા જણવાશે.

આ તાલીમ મેન્યુઅલમાં કોઈ ક્ષતિ રહી નથા પામેલ હોયતો અમારું ધ્યાન દોરવાના નામ વિનંતી જેથી યોજનામાં તેનો અમલ કરી શકાય.

ડૉ. જી. જી. રાદિયા,  
ડૉ. એચ. વી. પંડ્યા,  
ડૉ. એમ. બી. પટેલ,  
ડૉ. એમ. એસ. પુરોહિત  
ડૉ. એ. એન. સાબલપરા

તારીખ : ૩૦-૩-૦૮

સ્થળ : નવસારી

## ઃ આંબાની જીવાતો ૩૦

વિશ્વના કેરીના ઉત્પાદનની ૮૦ ટકા કેરી ભારતમાં પેદા થાય છે. જેમાંથી ગણનાપાત્ર નિકાસ પણ કરવામાં આવે છે. આ પાકમાં ૧૮૮ જેટલી જીવાતો નોંધયેલ છે. જે પૈકી ફળમાખી અને આંબાના મધિયાથી સારુએવું નુકશાન થાય છે.

### (૧) આંબાનો મધિયો :

*Amritodus atkinsoni* (અમૃતિટોડસ એટકીનસોની)

*Idioscopus clypealis* (ઈડીયોસ્કોપસ ક્લેપેલિસ)

*Idioscopus niveosparsus* (ઈડીયોસ્કોપસ નીવ્યોસ્પાર્સસ)

(Cicadellidae : Hemiptera)

### ઓળખ :

- ❖ બચ્ચાં અને પુખ્ત કીટક ફાચર આકારના અને જાંખા રાખોડી રંગના હોય છે. જે ખૂબ જ ઝડપથી ત્રાંસા ચાલતા હોય છે.
- ❖ ઈડામાંથી સેવાયેલા બચ્ચાં સફેદ રંગના હોય છે તેમજ નાની લાલાશ પડતા રંગની આંખોવાળા હોય છે. જે સમય જતાં ભૂરા રંગમાં પરિવર્તિત થાય છે.
- ❖ પુખ્ત કીટકના માથા ઉપર ગાઢા બદામી રંગના ત્રણા ટપકાં અને વર્ષ્યેના ભાગમાં પટ્ટો ધરાવતા હોય છે.
- ❖ *A. atkinsoni* કદમાં સૌથી મોટા તેમજ ગાઢા ભૂખરા રંગના ૪.૨ થી ૫.૧ મી. મી. જેટલા લાંબા હોય છે તેમજ છાંઘડાવાળી જગ્યામાં સંવર્ધન કરતાં હોય છે.
- ❖ *I. niveosparsus* મધ્યમ કદના ૪.૩ થી ૫.૩ મી. મી. જેટલા લાંબા જગ્યારે *I. clypealis* સાંકડા તેમજ કદમાં નાના ૩.૪ થી ૩.૮ મી. મી. જેટલા લાંબા હોય છે જેમનું સંવર્ધન સૌથી વધુ થતું જોવા મળે છે.

### જીવનક્રમ :

- ❖ સામાન્ય રીતે ઈડા મૂકવાની શરૂઆત નવેમ્બર મહિનામાં જોવા મળતી નવી કુપળોના પાન ઉપર થાય છે. માદા કીટક પાનની નીચેની બાજુએ મધ્યનસ તેમજ પુષ્પ વિન્યાસમાં કૂમળા ભાગોમાં એકલ દોકલ રીતે ઈડા મૂકે છે.
- ❖ એક માદા કીટક અંદાજીત ૧૦૦ થી ૨૦૦ જેટલા ઈડા મૂકે છે.
- ❖ ઈડા અવસ્થા ૪ થી ૭ દિવસની હોય છે.
- ❖ બચ્ચાં અવસ્થા ૧૦ થી ૧૫ દિવસની હોય છે.

- ❖ આ રીતે ૨૫ થી ૨૮ દિવસમાં જીવનક્રમ પુરો થાય છે.
- ❖ સામાન્ય રીતે મધ્યિયાનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. પરંતુ મોર બેસવાના સમયે તેની સંખ્યામાં એકાએક વધારો થતા જોવા મળે છે.
- ❖ કેરીની સીજન પુરી થયા બાદ પુખ્ત ક્રીટક સુષુપ્ત અવસ્થા જાડના થડ પર રહેલી તીરાડોમાં પસાર કરે છે અને ફરીથી ઓક્ટોબર મહિનાના અંતમાં સક્રિય થાય છે.

#### નુકશાન :

- ❖ માદા ક્રીટક પુષ્પવિન્યાસના કુમળા ભાગોમાં વધુ ઈડા મૂકે ત્યારે આ ભાગો સુકાઈ અને ખરી જાય છે.
- ❖ બચ્ચાં અને પૂખ્ત ક્રીટક કુમળા પાન, તેમજ પુષ્પવિન્યાસના જુદા જુદા ભાગોમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે.
- ❖ વધુ ઉપદ્રવના કારણે પાન તરડાઈને બેડોળ આકારના થાય છે. જ્યારે પુષ્પવિન્યાસના કુમળા ભાગો સુકાઈ જવાથી વટાણાથી નાની કેરીઓ સુકાઈને ખરી પડે છે.
- ❖ આ ઉપરાંત આ ક્રીટકના શરીરમાંથી ઝરતો મધ જેવો ચીકણો પદાર્થ પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે જે પ્રકાશસંશ્લેષણ ક્રિયાને અવરોધે છે.
- ❖ આ જીવાતને ભેજ અને છાંયડાવાળું હવામાન વધુ અનુકૂળ આવે છે. આ જીવાતનો ઉપદ્રવ આકૂસ સરદાર અને લંગડો જાતોમાં વધુ જોવા મળે છે.

#### અવલોકન પદ્ધતિ :

- ❖ નિયત કરેલ આંબાવાડિયામાં અસ્તવ્યસ્ત પદ્ધતિથી ૧૦ ઝડ પસંદ કરવા.
- ❖ આંબાના જાડની ફરતેથી રેન્ડમ પદ્ધતિથી ૧૦ કુંપળો /પુષ્પવિન્યાસ પસંદ કરી દરેક કુંપળ /પુષ્પવિન્યાસ પર મધ્યિયાના પુખ્ત અને બચ્ચાંની ગણતરી કરવી.

#### અવલોકન નોંધ :

ઝડ નંબર	કુંપળ/પુષ્પવિન્યાસ દીઠ મધ્યિયાના પુખ્ત અને બચ્ચાંની સંખ્યા										કુલ
	૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦	
૧	કુલ ૧૦૦ કુંપળો/પુષ્પવિન્યાસ પર જોવા મળેલ મધ્યિયાના પુખ્ત અને બચ્ચાંની સંખ્યાને ૧૦૦ વડે ભાગતા જે સંખ્યા આવે તેને નશીકની પુર્ણાંક સંખ્યામાં ફરતીને અવલોકન કરીમાં દર્શાવવી.										
૧૦											
કુલ :											

સરેરાશ : .....

ક્ષમ્યમાત્રા: કુંપળ/પુષ્પવિન્યાસ દીઠ સરેરાશ પાંચ બચ્ચાં અને પુખ્ત.

### **નિયંત્રણ વ્યવસ્થાપન :**

- ❖ આંબાના જાડ ખૂબ જ મોટા થઈ ગયા હોય ત્યાં જરૂર મુજબની છટણી કરવી જેથી સૂર્યપ્રકાશ જમીન સુધી દાખલ થઈ શકે.
- ❖ આંબાવાડીમાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી.
- ❖ સુષુપ્ત અવસ્થામાં રહેલ પૂખ્ત કીટકોના નાશ માટે ઓક્ટોબર મહિનામાં કાર્બારીલ ૫૦ ટકા પાણીમાં ઓગળી શકે તેવો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગળી જાડના થડ તેમજ જાડી ડાળીઓ પર છંટકાવ કરવો.
- ❖ મોર ખીલે તે પહેલા સીન્થેટીક પાયરેથ્રોઇડ ગ્રૂપની દવાઓ જેવી કે ડેલ્ટામેથીન ૨.૮ ટકા ઈસી ઉ મી. લી. અથવા સાયપરમેથીન ૨૫ ટકા ઈસી ૧.૨ મી. લી. અથવા આલ્ફામેથીન ૧૦ ટકા ઈસી ૧.૭ મી. લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેણવીને છંટકાવ કરવો.
- ❖ નીઓનીકોટીનોઇડ ગ્રૂપની ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ ટકા એસએલ ૨.૮ મી. લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેણવીને છંટકાવ કરવો.
- ❖ આ ઉપરાંત ફેનોબુકાર્બ ૫૦ ટકા ઈસી ૨૦ મી. લી. અથવા કવીનાલફોસ ૨૦ ટકા ઈસી ૨૫ મી. લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેણવીને છંટકાવ કરવાથી પણ મવિયાનું નિયંત્રણ થઈ શકે છે.

### **(૨) આંબાની શ્રીપસ :**

*Caliothrips indicus* (કેલીથ્રોશ્રીપસ ઇન્ડિકસ)

**(Thripidae : Thysanoptera)**

---

### **ઓળખ :**

- ❖ આ જીવાત કદમાં નાની ફીકકા પીળા રંગની ૧ મી. મી. લાંબી પોચા શરીરવાળી, નાજુક અને પીછાં જેવી પાંખોવાળી હોય છે.

### **નુકશાન :**

- ❖ માદા કીટક આંબાના કૂમળા પાનમાં ઈડા મૂકે છે.
- ❖ બરયાં અને પૂખ્ત કીટકો દ્રારા કૂમળા પાનની સપાટી પર ઘસરકા કરવાને કારણે રસનું ઝરણ થાય છે જે ચૂસીને કીટકો નુકશાન કરે છે. પરિણામ સ્વરૂપ ઉપદ્રવિત ભાગ કાંસા જેવા રંગમાં પરિવર્તિત થાય છે. આ ભાગોમાં જોવા મળતા કાળા ટપકાં જીવાતની હધારના હોય છે.
- ❖ જીવાતનો વધુ ઉપદ્રવ હોય તો કૂમળા પાનની ઘારો વળી જાય છે.

- ❖ આંબાના મોર ઉપર આ જીવાતનો ઉપદ્રવ થાય તો તે પીળો પડી સુકાઈ જાય છે.
- ❖ કૂમળી કેરી પર વધુ ઉપદ્રવ હોય તો ફળનો રંગ ચીકુ જેવો થઈ જાય છે.

### અવલોકન પદ્ધતિ :

- ❖ નિયત કરેલ આંબાવાડિયામાં અસ્તવ્યસ્ત પદ્ધતિથી ૧૦ ઝાડ પસંદ કરવા.
- ❖ દરેક ઝાડ પર રેન્ડમ પદ્ધતિથી ફરતેની ૧૦ પ્રશાખા (શુટ) પર શ્રીપ્સની હાજરી તપાસવી.
- ❖ પસંદ કરેલ પ્રશાખાને સફેદ કોરા કાગળ પર ખંખેરી શ્રીપ્સની સંખ્યા નોંધવી.

### અવલોકન નોંધ :

ઝાડ નંબર	પ્રશાખા દીઠ જોવા મળેલ શ્રીપ્સની સંખ્યા										કુલ
	૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦	
૧	કુલ ૧૦૦ પ્રશાખાને કાગળ પર ખંખેરતા જોવા મળેલ કુલ શ્રીપ્સની સંખ્યાને ૧૦૦ વડે ભાગતા જે										
૧૦	સંખ્યા આવે તેને નજીકની પુણાંક સંખ્યામાં ફેરવીને અવલોકન કાર્ડમાં દર્શાવવી.										
કુલ :											

સરેરાશ : .....

### ક્ષમ્યમાત્રા :

- ❖ ૧૦ બચ્યાં અને પુખ પ્રતિ પ્રશાખા.

### નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ આંબાના મધિયા માટે દર્શાવેલ પાક સંરક્ષણના ઉપાયો હાથ ધરવાથી આ જીવાતનું પણ અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
- ❖ લીમડા આધારીત ૧૫૦૦ પી. પી. એમ. જંતુનાશક દવા ૩૦ મી. લી. ૧૦ લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવાથી પણ ઉપદ્રવને કાબુમાં રાખી શકાય છે.

### (૩) આંબાની ફળમાખી :

- (1) *Bactrocera dorsalis* (બેક્ટ્રોસેરા ડોર્સાલિસ)
- (2) *Bactrocera zonata* (બેક્ટ્રોસેરા ઝોનેટા)
- (3) *Bactrocera correcta* (બેક્ટ્રોસેરા કરેક્ટા)
- (4) *Bactrocera diversa* (બેક્ટ્રોસેરા ડાયવસા)

## (Tephritidae : Diptera)

### ઓળખ :

- ❖ ફળમાખી બદામી રંગની અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે.
- ❖ માખીના પગો પીળા રંગના હોવાથી સોનેરી માખી તરીકે પણ ઓળખાય છે.
- ❖ પૂર્ણ વિકસીત કીડા ૮ થી ૯ મી. મી. લાંબા અને ઝાંખા સફેદ રંગના પગ વગરના હોય છે જે મોઢાના ભાગ તરફ આણીદાર હોય છે.

### જીવનક્રમ :

- ❖ દક્ષિણ ગુજરાતમાં ચીકુના પાકમાં આ જીવાતનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે.
- ❖ કેરીના પાકમાં મે થી ઓગષ્ટ દરમ્યાન સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે.
- ❖ પુન્ન કીટક પાકા ફળોમાંથી નીકળતા રસ તેમજ કેટલાક કીટકોના શરીરમાંથી જરણ થતાં ચીકુણા મધ જેવા પ્રવાહી ખાઈને ચાર મહિના સુધી જીવી શકે છે.
- ❖ દશ થી પંદર દિવસ બાદ માદા કીટક ફળની છાલની નીચે ૧ થી ૪ મી. મી. ઉડાઈએ ૨ થી ૧૫ના જથ્થામાં ઈડા મૂકે છે.
- ❖ એક માદા ફળમાખી આશરે ૨૦૦ જેટલા ઈડા મૂકે છે.
- ❖ ઈડા અવસ્થા ૨ થી ૩ દિવસની હોય છે.
- ❖ કીડો ત્રણ વખત કાંચળી બદલીને ૬ થી ૨૮ દિવસમાં પૂર્ણ વિકસીત બને છે.
- ❖ પૂર્ણ વિકસીત કીડો ફળમાંથી બહાર નીકળી જમીનમાં ૮ થી ૧૫ સે. મી. ની ઉડાઈએ કોશોટામાં રૂપાંતર પામે છે.
- ❖ કોશોટા અવસ્થા જે તે ઋતુ મુજબ ૬ થી ૪૪ દિવસની હોય છે. આ રીતે ૨ થી ૧૫ અઠવાડિયામાં જીવનક્રમ પુરો થાય છે. વર્ષમાં ૧૦ થી ૧૨ પેઢીઓ તૈયાર થાય છે.

### નુકશાન :

- ❖ આ જીવાતની માદા માખી ફળની છાલની નીચે ઈડા મૂકે છે. પરિણામસ્વરૂપ કાણામાંથી રસ જરે છે. ઈડા મુકેલી જગ્યાએ ફળનો વિકાસ અટકી જવાથી ફળની સપાટી પર દબાયેલા ખાડા જોવા મળે છે. જેના પરથી પણ ઉપદ્રવનો ઘ્યાલ આવી શકે છે.

- ❖ અનુકૂળ પરિસ્થિતિમાં ઈડામાંથી કીડા નીકળી ફળની અંદરનો ભાગ ખાવાનું શરૂ કરે છે. પરિણામ સ્વરૂપ ફળમાં કહોવાટ પેદા થાય છે. અંતે ઉપદ્રવિત ફળ ઝડ પરથી ખરી પડે છે. આ રીતે ઉત્પાદન પર માઠી અસર થાય છે.
- ❖ કેરી પાકવાના સમયે ઉપદ્રવ હોય તો કેરી ઉતાર્યા બાદ પકવવા માટે વખારમાં પાથરવામાં આવે ત્યારે ઈડાઓનું સેવન થાય છે. ઈડામાંથી નીકળતા કીડા પાકતી કેરીનો અંદરનો ગર્ભ ખાતા હોવાથી ઉપદ્રવિત ફળમાંથી તીવ્ર પ્રકારની અણગમતી વાસ આવે છે. ફળ ખાવા લાયક રહેતા નથી. આ રીતે કેરી ખરીદનારને નુકશાન થાય છે જ્યારે જે તે વિસ્તારના ખેડૂતોની શાખ ઉપર અસર થાય છે.

#### અવલોકન પદ્ધતિ :

- નિયત કરેલ આંબાવાડીયામાં નર ફળમાખીને આકર્ષવા માટે "મિથાઈલ યુજીનોલ" ટ્રેપ ગોઠવવા. હેક્ટર દીટ ત્રાણ ટ્રેપની જરૂરીયાત રહેશે. બે ટ્રેપ વચ્ચે ૧૦૦ મીટર કરતાં ઓછું અંતર રાખવું નહિ.
- ટ્રેપમાં આકર્ષયિલ જીવતી ફળમાખીઓની સંખ્યા દર સોમવારે સવારે ૮ થી ૧૮ વાગ્યાના ગાળામાં નોંધવી.

#### અવલોકન નોંધ :

ટ્રેપ નંબર	ટ્રેપમાં પુમડું મૂક્યા પહેલા કુલ ફળમાખીની સંખ્યા	મિથાઈલ યુજીનોલનું પુમડું મૂક્યા બાદ એક કલાક પછી ફળમાખીની સંખ્યા
૧		
૩		
કુલ :	જે સંખ્યા જોવા મળેલ તે વિશેષ નોંધમાં દર્શાવવી.	જે સંખ્યા જોવા મળે તેને અવલોકન કાર્ડમાં દર્શાવવી.

#### નોંધ :

- પુમડું મુક્યા પહેલા અઠવાડિયા દરમ્યાન ટ્રેપમાં પકડાયેલ ફળમાખીની કુલ સંખ્યા (મૃત/જીવીત) અવલોકન કાર્ડની વિશેષ નોંધમાં દર્શાવવી અને જીવીત ફળમાખી હોય તો તેનો ડાયકલોરવોસથી નાશ કરવો. ત્યારબાદ ટ્રેપમાં મિથાઈલ યુજીનોલનું પુમડું બદલી એક કલાક બાદ ટ્રેપમાં પકડાયેલ ફળમાખીની સંખ્યા અવલોકનના ખાનામાં દર્શાવવી.

#### ક્ષમ્યમાત્રા :

- ❖ ફળમાખીની હાજરી

#### નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ ફળમખીના નિયંત્રણ માટે નીચે દર્શાવેલા ઉપાયો સામુહિક રીતે હાથ ધરવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે.

- ❖ આંબાવાડીયામાં સ્વચ્છતા જાળવવી તેમજ નીચે ખરી પડેલ ઉપદ્રવિત ફળોને દરરોજ ભેગા કરી તેને ઉંડા ખાડામાં દાટી પાણીથી ખાડાને તર કરી દેવાથી ઉપદ્રવિત ફળમાં રહેલા કીડાનો નાશ થઈ શકે છે.
- ❖ ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી જાડની ફરતે અવારનવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે.
- ❖ કાળી તુલસીના પાનમાં મીથાઈલ યુજીનોલ નામનું રસાયણ હોય છે જે *Bactrocera dorsalis*, *B. zonata* અને *B. correcta* જાતીના નર કીટકોને આકર્ષિતું હોવાથી આંબાવાડીયા તેમજ શેઢા પર કાળી તુલસીનું વાવેતર કરી તુલસીના છોડ પર ફેન્થીઓન ૧૦૦ ટકા ઈસી ૧૦ મી. લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેણવીને કેરીની સીજાન દરમ્યાન ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવાથી નર ફળમાખીનું નિયંત્રણ કરી શકાય છે.
- ❖ મીથાઈલ યુજીનોલ ટ્રેપનો ઉપયોગ કરી ફળમાખીના નર કીટકોને આકર્ષિતે નાશ કરી શકાય છે. આવા ટ્રેપમાં મીથાઈલ યુજીનોલ તથા ડાયકલોરવોસ ૭૬ ટકા દવા ૧:૧ ના પ્રમાણમાં ભેણવી તૈયાર થયેલ દ્રાવણમાં રૂનું પૂંમહું બોળીને ટ્રેપમાં રાખવું. હેક્ટર દીઠ પાંચ થી સાત ટ્રેપ મૂકવા તેમજ દર અઠવાડિયે રૂનું પૂંમહું બદલી રીચાર્જ કરેલું રૂનું નવું પૂંમહું મૂકવું.
- ❖ ૫ × ૫ સે. મી. ના પ્લાયવુડ બ્લોકને ૪૦ મી. લી. મીથાઈલ યુજીનોલ +૬૦ મી. લી. ઈથાઈલ આલ્કોહોલ (અથવા અન્ય કોઈ સોલ્વંટ કે જેમા મીથાઈલ યુજીનોલને દ્રાવ્ય કરી શકાય) + ૧૦ મી. લી. ડાયકલોરવોસ ૭૬ ટકાનાં દ્રાવણમાં ૨૪ કલાક રૂખાડી રાખી છાંયડામાં સૂકવવા. આવા તૈયાર કરેલ પ થી ૫ બ્લોક પ્રતિ હેક્ટર આંબાવાડીયામાં ખીલી વડે થડ ઉપર ચોટાડવા.
- ❖ કીટકશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિધાલય, નવસારી દ્રારા વિકસાવવામાં આવેલ મેગા ટ્રેપ (ખોખા ટ્રેપ) થી પણ ખુબ જ ઓછા સમયમાં નર ફળમાખીનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે. આ માટે મીથાઈલ યુજીનોલ + સોલ્વંટ + ડાયકલોરવોસ ૪:૬:૧ ના પ્રમાણમાં તૈયાર કરેલ દ્રાવણ સારી રીતે શોખાઈ શકતું હોય તેવા ખોખાનો ઉપયોગ કરી શકાય છે. ઉપરોક્ત દ્રાવણને ખોખાની અંદરની સપાટીએ લગાડવું. ખોખાની ફરતે નર ફળ માખી દાખલ થવા માટે મોટા કાણાં પાડવા. આવા મેગા ટ્રેપ આંબાવાડી કે વાડીની અંદર આવેલ મકાનના ઓથ હેઠળ મૂકી શકાય છે.
- ❖ દર અઠવાડિયે મેગા ટ્રેપમાં ભેગી થયેલ ફળમાખીને એકઠી કરી નાશ કરવો.
- ❖ ટ્રેપને ઉપરોક્ત દ્રાવણથી જરૂરીયાત મુજબ ચાર્જ કરતા રહેવું.

#### (૪) આંબાનો મેછ:

*Batocera rubus* (બેટોસેરા રૂબસ)

*Batocera rufomaculata* (બેટોસેરા રૂફોમેક્યુલેટા)

(Cerambycidae :Coleoptera)

ઓળખ :

- ❖ પુખ્ત કીટક મજબુત બાંધાનું, પીળાશ પડતા બદામી રંગનું અને શરીર કરતાં મોટી શૃંગિકાવાળું ઢાલપક્ષ કીટક છે.
- ❖ ઈયળ મેછ કે ગ્રબ તરીકે ઓળખાય છે. જે પૂર્ણ વિકસીત ખંડવાળી, માંસલ દેહધારી, પીળાશ પડતા સફેદ રંગની હોય છે જ્યારે માથું બદામી રંગનું હોય છે. પૂર્ણ વિકસીત મેછ આશરે ૭ થી ૮ સે. મી. લાંબી હોય છે.

નુકશાન :

- ❖ પુખ્ત કીટક આંબાના કૂમળાં પાન પર નભે છે. પરંતુ તેનાથી થતું નુકશાન ગંભીર પ્રકારનું હોતું નથી. માદા કીટક જાડના થડની તિરાડમાં એકલ દોકલ ઈડા મૂકે છે જે સેવાતાં ઈયળ થડની છાલ કોરીને થડની અંદર ઉપરની બાજુએ કોરાણ કરી બોગણું બનાવે છે.
- ❖ ઈયળ અવસ્થા દ મહિના જેટલી હોવાના કારણે શરૂઆતમાં ઉપદ્રવનો ઘ્યાલ આવી શકતો નથી. પરંતુ ઈયળ જેમ જેમ મોટી થાય તેમ થડની અંદરના ભાગમાં કોરાણ કરતી હોવાથી વધારાના લાકડાનો વેર થડની બહાર નીકળતો જોઈ શકાય છે. જેના પરથી ઉપદ્રવનો ઘ્યાલ આવી શકે છે. એક થડમાં એક કે એકથી વધુ ઈયળો જોઈ શકાય છે.
- ❖ વધુ ઉપદ્રવ હોય તો જાડની ડાળીઓ ઉપર આવેલ પાન મુરજાતા જોવા મળે છે આખરે ડાળી સુકાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો આખું જાડ સુકાઈ જાય છે.

નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ આંબાવાડીમાં નિયમિત રીતે મોજણી કરતા રહેવું. જેથી સમયસર ઉપદ્રવનો ઘ્યાલ આવી શકે.
- ❖ ઉપદ્રવિત થડમાં પાતળી સળી દાખલ કરી થડને હળવી ટપલી મારવાથી અંદર રહેલી ઈયળ બહાર આવવા પ્રયત્ન કરે છે. આ રીતે બહાર નીકળવા પ્રયત્ન કરતી ઈયળને ત્વરાથી પકડીને બહાર ખેંચી તેનો નાશ કરવો.

- ❖ ઈયળ ખૂબ જ ઉતે સુધી દાખલ થઈ ગયેલ હોય તો અણીવાળા લોખંડના તારથી ઈયળને થડની અંદર જ મારી નાંખવી. ત્યારબાદ મોનોકોટોફોસ ઉફ ટકા ૫ મી. લી. + ડાયકલોરવોસ ઉફ ટકા ૫ મી.લી. દવા ૧ લીટર પાણીમાં ભેળવી તૈયાર કરેલ મિશ્રણને મોટા ઈન્જેક્શનની મદદથી કાણાંમા દાખલ કરવું. ત્યારબાદ કાણાંને ભીની માટીથી બંધ કરી દેવું.
- ❖ કોઈ પણ સંજોગોમાં કેરોસીનનો ઉપયોગ કરવો નહીં.
- ❖ કાણાંમાં એલ્યુમીનીયમ ફોસ્ફાઇડની અડવી ટીકડી મૂકી કાણાં તેમજ થડના બહારના ભાગમાં ભીની માટીથી લીપી દેવાથી અંદર રહેલી ઈયળોનો નાશ થઈ શકે છે.

#### (૫) આંબાનો ચીકટો :

*Drosicha mangiferae* (ક્રોસીચા મેન્ગિફરી)

(Margarodidae : Hemiptera)

#### ઓળખ :

- ❖ બચ્ચાં અને પુખ્ત માદા કીટક ચપટાં અને લંબગોળાકાર હોય છે. જેના પર સમય જતાં મીણના તાંત્રણાંઓ વિકાસ થતાં આખું શરીર રૂ જેવા ભાગોથી ઢંકાયેલુ જોવા મળે છે.
- ❖ નર કીટક કદમાં નાના, એક જોડી પાંખવાળા, લાલાશ પડતા શરીરવાળા હોય છે.

#### નુકશાન :

- ❖ બચ્ચાં તેમજ માદા કીટક કૂમળા પાન, હુંખ ,કુમળી ડાળીઓ તથા ફળ અને તેનાં ડીટાં પર જામી જઈ રસ ચૂસે છે. ફળ પર મીલીબંસ લાગવાથી ફળની ગુણવત્તા પર માઠી અસર પડે છે.
- ❖ માર્યના અંતથી મે દરમ્યાન પુખ્ત માદા કીટક જાડ પરથી ઉતરી જમીનમાં ૮૦ થી ૧૫૦ મી. મી. ઉતે સફેદ ગોળાકાર કે લંબગોળાકાર બોગદું બનાવી તેમા ઈડા મૂકે છે. ત્યારબાદ માદા મૃત્યુ પામે છે.
- ❖ આવા ઈડા જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે.
- ❖ શિયાળાની ઠંડી ઈડાની સુષુપ્ત અવસ્થા ભંગ કરે છે. જેથી તે સેવાય છે અને ઈડામાંથી નીકળેલાં બચ્ચાં જાડના થડ પર થઈ ડાળીઓ સુધી પહોંચી જાય છે.
- ❖ ઘણી વખત રાતી કીરીઓ બચ્ચાંને જાડ પર ચઢવામાં આડકતરી રીતે મદદ કરતી હોય છે.

#### નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ માદા કીટક જમીનમાં ઈડા મૂકતી હોવાથી ઉનાળામાં તથા ચોમાસુ પુરુ થયે જાડની ફરતે ખેડ કરતાં રહેવું.

- ❖ ઝાડની ફરતે જમીન પર મીથાઈલ પેરાથીઓનની ૨ ટકાની ભૂકી નવેમ્બર મહિનામાં થડની ફરતે ગોડ કર્યા બાદ ભભરાવવાથી ઈડામાંથી નીકળતા બચ્ચાનો નાશ થઈ જશે.
- ❖ ઝાડના થડની ફરતે જમીનથી એક મીટર ઉચ્ચે પ્લાસ્ટિકનો પટ્ટો લગાડીને તેની બજે ધારો પર ગ્રીસ અથવા કોઈ ચીકણો પદાર્થ લગાવવાથી બચ્ચાને ઝાડ પર ચઢતાં રોકી શકાય છે.
- ❖ નીચે દર્શાવેલ જંતુનાશક દવાઓ પૈકી કોઈપણ એકનો છંટકાવ કરવો.

જંતુનાશક દવાનું નામ	૧૦ લીટર પાણીમાં દવાનો જથ્થો
કલોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી	૨૫ મી. લી.
એસીટામીપ્રીડ ૨૦ ટકા એસ. પી.	૨ ગ્રામ
થાયોમેથોક્ઝામ ૨૫ ટકા ઇબલ્યુ જી.	૧.૫ ગ્રામ
થાયોડીકાર્બ ૭૫ ટકા ડાબલ્યુ. પી.	૭.૫ ગ્રામ
કવીનાલફોસ ૨૫ ટકા ઈ. સી.	૨૦ મી. લી.
પ્રોફેનોફોસ ૫૦ ટકા ઈ. સી.	૧૨ મી. લી.
ડાયકલોરવોસ ૭૫ ટકા	૧૦ મી. લી.
એસીફેટ ૭૫ ટકા સોલ્યુબલ પાવડર	૧૫ ગ્રામ દવા

આ જીવાતનું શરીર મીણના પાવડરથી ઢંકાયેલું હોવાથી જંતુનાશક દવા સાથે સારી ગુણવત્તાવાળો સાખુનો પાવડર ૧ થી ૨ ગ્રામ અથવા પ્રવાહી સાખુ જેવા કે સેન્ડોવીટ, ટીપોલ કે પાવર એક્ટીવેટર ૧ થી ૨ મી. લી. પ્રતિ લીટર પાણીમાં ઉમેરવાથી જંતુનાશક દવાની અસરકારકતા વધારી શકાય છે. જો સાખુનો પાવડર હોય તો ૧૫ લીટરના પ્રવાહી મિશ્રણ માટે સૌ પ્રથમ ૧૫ થી ૩૦ ગ્રામ સાખુનો પાવડર થોડા પાણીમાં ઓગાળી ત્યારબાદ તેને ગાળીને આ દ્રાવણ પંપમાં ઉમેરવું. જેથી છંટકાવ કરતી વખતે કોઈ મુશ્કેલી ઉભી ન થાય અને એક સરખો છંટકાવ થઈ શકે.

#### (૬) કેરીના ગોટલાનું ચાંચવું :

*Sternochetus mangiferae* (સ્ટરનોચેટસ મેન્જીફેરી)

(Curculionidae : Coleoptera)

ઓળખ :

- ❖ ઈડા ખૂબ જ નાના અને સફેદ રંગના હોય છે.
- ❖ પૂર્ણ વિકસીત ઈયળ પગ વગરની માંસલ સફેદ શરીરવાળી અને ગાઢા બદામી રંગના માથાવાળી હોય છે.
- ❖ પુખ્ત કીટક આશારે ૧૨ થી ૧૫ મી. મી. લાંબું, ગાઢા બદામી રંગનું હોય છે.

નુકશાન :

- ❖ માદા કીટક વિકસતા ફળ પર કે ખરી પડવાની તૈયારીમાં હોય તેવા ફળની છાલ નીચે ઈડા મૂકે છે.

- ❖ ઈડામાંથી નીકળતી ઈયળ ફળનો ગર્ભ કોરી કેરીની ગોટલી સુધી પહોંચી ગોટલીનો અંદરનો ભાગ કોરી ખાય છે.
- ❖ કોશોટો અવસ્થા ગોટલીમાં જ બને છે.
- ❖ પુખ્ત કીટક ગોટલીમાંથી નીકળી પાક ફળના માવામાં રસ્તો કરી બહાર આવે છે. જેથી ફળ ખાવાલાયક રહેતું નથી.
- ❖ આ જીવાતના ઉપદ્રવને કારણે કેરી પરદેશ મોકલી શકાતી નથી.

#### **નિયંત્રણ વ્યવસ્થાપન :**

- ❖ આંબામાં કેરી બેઠાના ઢોઢ મહિના બાદ ખરી પડેલ બધા જ મરવા ભેગા કરી નાશ કરવો.
- ❖ કેરીના ગોટલાને ૧૨ ડીગ્રી સે. તાપમાને ૪૮ કલાક સુધી રાખવામાં આવે તો ગોટલામાં રહેલ ઈયળ, કોશોટો તથા પુખ્ત કીટકોનો નાશ થાય છે.
- ❖ કેરીના રસનું પ્રોસેસીંગ કરતી ફેક્ટરીઓ દ્વારા ગોટલાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો આ જીવાતના ઉપદ્રવને કાબુમાં રાખી શકાય છે.
- ❖ આંબાની ફળમાખી તેમજ મધિયાના નિયંત્રણ માટે સમયસર પાકસંરક્ષણના પગલાઓ હાથ ધરવામાં આવે તો આ જીવાતના ઉપદ્રવને પણ કાબુમાં રાખી શકાય છે.

#### **(૭) આંબાનો દૂંખ વેદક / મોરની દૂંખ કોરી ખાનાર ઈયળ :**

*Chlumetia transversa* (કલુમેસીઆ ટ્રાન્સવરસા)

(Noctuidae : Lepidoptera)

#### **નુકશાન :**

- ❖ માદા કીટક કુમળા પાન પર ઈડા મૂકે છે.
- ❖ ઈડામાંથી નીકળેલી ઈયળ શરૂઆતમાં કુમળા પાનની મધ્યનસમાં દાખલ થાય છે અને ત્યારબાદ ઈયળ રોપાની દૂંખમાં દાખલ થઈ ઉપરથી નીચેની તરફ કોરાણ કરે છે.
- ❖ નુકશાનવાળી દૂંખના પાન ચીમળાઈ જાય છે.
- ❖ નવી બાંધેલી કલમોમાં ઉપદ્રવ ગંભીર પ્રમાણમાં જોવા મળે છે.
- ❖ આંબામાં મોર આવે ત્યારે ઈયળ કુમળા પુષ્પવિન્યાસનો અંદરનો ભાગ ખાઈ જતી હોવાથી મોર સુકાઈ જાય છે. તેથી કેરી બેસતી નથી.

### નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ ઉપદ્રવવાળી ઝૂંખો અને મોરની ડાળીઓ કાપીને ઈયળ સહિત નાશ કરવો.
- ❖ વધુ ઉપદ્રવ હોય તો કાર્બારીલ ૫૦ ટકા પાણીમાં ઓગાળી શકે તેવા પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

### (૮) ઉધઈ :

*Termes obesus* (ટર્મીસ ઓબેસસ)

*Trinervitermes biformis* (ટ્રાન્નરવીટરમીસ બાયફોરમીસ)

(Termitidae : Isoptera)

### નુકશાન :

- ❖ ઉધઈ સમૂહમાં રહેતું સામાજીક ક્રીટક છે.
- ❖ ઉધઈના રાફડામાં જુદી જુદી જાતીઓ જોવા મળે છે જે પૈકી કામદાર વર્ગ ખેતી પાકોમાં વધુમાં વધુ નુકશાન કરે છે.
- ❖ રાજા અને રાણી પ્રજનનનું કાર્ય, જ્યારે સિપાહી ઉધઈના કુદરતી દુષ્મનો સામે રાફડાનું રક્ષણ કરવાનું કામ કરે છે.
- ❖ ઉધઈ સૂર્યપ્રકાશથી દૂર જમીનમાં રહી પાકના મૂળ અને સોન્દિય કચરો ખાય છે.
- ❖ ઝાડના થડ પર માટીની ગેલેરીઓ બનાવી તેની નીચે રહી ઝાડની છાલ કોરી ખાય છે.
- ❖ થડ પર ઘા પડયો હોય અથવા ડાળી તૂટેલી હોય ત્યાંથી થડના મધ્યમાં ઉધઈ દાખલ થઈ અંદર વધે છે અને ઝાડની જીંદગી ટુંકાવે છે.
- ❖ ઉધઈ નર્સરીના રોપાઓને તથા આંબાવાડીમાં રોપેલી ઉગતી કલમોને પણ નુકશાન કરે છે.

### નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ શેઢા પાળા પર કે આંબાવાડિયામાં ઉધઈના રાફડાનો રાણી સહિત નાશ કરવો.
- ❖ ઉધઈનો રાફડો કોણાળીથી ખોઢી નાખ્યા બાદ ૧૦ લીટર પાણીમાં કલોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી ૨૫૦ મી. લી. પ્રમાણે ભેળવી જમીન પર દરેકવાથી ઉધઈની કોલોનીમાં રહેલ રાણી, મજૂર તથા સૈનિકનો નાશ થઈ શકે છે.

- ❖ નવા રોપેલા આંબાના છોડ પૂરે પૂરા ચોટી જાય ત્યાં સુધી ઉધઈ સામે રક્ષણ આપવા માટે કલમ રોપતા પહેલા કલોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી ૫૦ મી. લી. દવા એક લીટર પાણીમાં ભેળવી ખાડામાં ચારે તરફ નાખવી અને આશરે છ મહિના બાદ તેટલું જ મિશ્રણ કલમના સાંઘાથી નીચેના થડનો ભાગ પલણે તેમ રેડવું.
- ❖ આંબાવાડિયામાં ઝડની આજુબાજુ ઉડી ખેડ કરવાથી અને વધુ પાણી આપવાથી ઉધઈનો ઉપદ્રવ ઘટે છે.

#### (૯) રાતી કીડી :

*Oecophylla smaragdina* (ઇકોફાયલા સ્મારગડીના)

(Formicidae :Hymenoptera)

#### નુકશાન :

- ❖ રાતી કીડી આંબાની ડાળીના કૂમળાં પાન રેશમી તાંત્રણાથી ગુંથીને માળો બનાવીને તેમાં રહે છે.
- ❖ રાતી કીડી માંસ ભક્ષી ગણાય છે કારણકે કેટલીક જાતના નાના કીટકોનું ભક્ષણ પણ કરે છે.
- ❖ સામાન્ય રીતે રાતી કીડી આખું વર્ષ કાર્યશીલ રહે છે. પરંતુ ચોમાસામાં તેની કાર્યશીલતા ઘટી જાય છે.
- ❖ રાતી કીડીશી સીધે સીધું નુકશાન થતું નથી પરંતુ તેના માળામાં ચીકટો, ભીગડાવાળી જીવાત અને મોલો જેવા કીટકોને તેમના કુદરતી દુશમનો સામે રક્ષણ બક્ષે છે. આ કીટકોનું એક ઝડ પરથી બીજા ઝડ પર વહન પણ કરે છે.
- ❖ આ ઉપરાંત આંબાના ફળ તોડવા ચેલા માણસને ચટકા ભરીને પરેશાન કરી નાંબે છે.

#### નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ ઝડ પરના રાતી કીડીના માળાને તોડીને બાળીને નાશ કરવા.
- ❖ ઝડના થડ પર અને ઝડની નીચે જમીન પર મીથાઈલ પેરાથીઓન ૨ ટકાની ભૂકી ભભરાવાથી અસરકારક નિયંત્રણ મળે છે.

#### (૧૦) આંબાની ગાંઢીયા માખી :

*Procontarinia matteima* (પ્રોકોન્ટારીનીયા મેટીએના)

(Cecidomyidae : Diptera)

#### નુકશાન :

- ❖ માદા માખી પાનની નીચેની બાજુએ ઈડા મૂકે છે.
- ❖ ઈડા સેવાતાં ક્રીડો પાનની પેશી કોરીને નુકશાન કરે છે.

- ❖ કોરેલા ભાગમાં ગાંઠ ઉપસી આવે છે.

#### **નિયંત્રણ વ્યવસ્થાપન :**

- ❖ ઉપદ્રવવાળા પાન ભેગાં કરી નાશ કરવો.
- ❖ નવા પાન પર ઉપદ્રવ જણાતા ડીડીવીપી રૂ ૭૫ ટકા ૫ મી. લી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને ૨૦ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

## ચીકુની જીવાતો

ચીકુના પાકમાં નુકશાન કરતી ૨૫ જેટલી જીવાતો છે જે પૈકી કળી કોરનાર ઈયળ, ચીકુમોથ, ફળખામી, બીજ કોરીખારનાર ઈયળ, પાનકોરીયુ, પાનની ઘાર વાળનારી ઈયળ, ઘોડીયા ઈયળ અને ફળ કથીરી મુખ્ય ગણાવી શકાય. જ્યારે પાન ખાનાર કાતરા, ભીગડાવાળી જીવાત, ચીકટો, મોલોમશી, રાતીકીડી, ફળની છાલ કોરી ખાનારી ઈયળ કે થડનો મેઠનો ગૌણ જીવાતોમાં સમાવેશ થાય છે.

(૧) ચીકુ બડ બોરર :

*Anarsia achrasella* (એનારસીયા એકરેસેલા)

(Gelechiidae : Lepidoptera)

ઓળખ :

- ❖ કુંદા કદમાં નાના હોય છે જેની અગ્ર પાંખો ગાઢા રાખોડીયા રંગની જ્યારે પાછળની પાંખો પીળા રંગની પીછાં જેવી ઘારોવાળી હોય છે.
- ❖ પૂર્ણ વિકસીત ઈયળ ૮ થી ૧૦ મી. મી. લાંબી અને રતાશ પડતા ઘેરા રંગના માથાવાળી હોય છે. માથા અને ઉદર પ્રદેશની વર્ણના ભાગ પર સફેદ આડો પટ્ટો હોય છે.

નુકશાન :

- ❖ માદા કીટક કળી પર સફેદ રંગના છૂટા છવાયા ઈડા મૂકે છે.
- ❖ ઈડા ૨ થી ૮ દિવસમાં સેવાય છે.
- ❖ ઈડામાંથી નીકળેલી ઈયળ કળીના ઉપરના ભાગમાં કાણું પાડીને દાખલ થાય છે અને અંદરનો ભાગ કોરી ખાય છે.
- ❖ ઉપદ્રવિત કળીની ફરતે કાણાં જોવા મળે છે તેમજ કળીનો કેટલોક ભાગ સંપૂર્ણ રીતે ખવાઈ ગયેલો જોવા મળે છે. આ રીતે ઉપદ્રવિત કળી ઈયળોની હઘાર સાથે સમયાંતરે સુકાઈ જાય છે. ઈયળ અવસ્થા ૧૦ થી ૧૪ દિવસની હોય છે. સમગ્ર ઈયળ અવસ્થા દરમ્યાન એક ઈયળ આશરે ત્રણેક કળીઓને નુકશાન કરે છે. પૂર્ણ વિકસીત ઈયળ કળી ઉપર અથવા કળીમાં ઈટ જેવા લાલ રંગનો કોશેટો બનાવે છે.
- ❖ આ જીવાતનો ઉપદ્રવ ફેખુઆરી થી જુન દરમ્યાન વધુ પ્રમાણમાં જોવા મળે છે.

## અવલોકન પદ્ધતિ :

- ❖ નિયત કરેલ ચીકુવાડિયામાંથી અસ્તવ્યસ્ત પદ્ધતિથી ૧૦ ઝડપ પસંદ કરવા.
- ❖ ઝડપની ફરતે રેન્ડમ પદ્ધતિથી પાંચ પ્રશાખા પસંદ કરવી.
- ❖ દરેક પ્રશાખા પરની ઉપદ્રવિત કળીઓ અને બિનઉપદ્રવિત કળીઓની નોંધ કરવી.

## અવલોકન નોંધ :

ઝડપ નંબર	પ્રશાખા પરની ડાળીઓ											
	૧		૨		૩		૪		૫		કુલ	
	ઉપદ્રવિત કળીઓ	બિન ઉપદ્રવિત કળીઓ	ઉપદ્રવિત કળીઓ	બિન ઉપદ્રવિત કળીઓ	ઉપદ્રવિત કળીઓ	બિન ઉપદ્રવિત કળીઓ	ઉપદ્રવિત કળીઓ	બિન ઉપદ્રવિત કળીઓ	ઉપદ્રવિત કળીઓ	બિન ઉપદ્રવિત કળીઓ	ઉપદ્રવિત કળીઓ	બિન ઉપદ્રવિત કળીઓ
૧ ૧૦												
કુલ :												

ઉપદ્રવિત કળીના ટકા : .....

ક્ષમ્યમાત્રા : ૧૦ ટકા ઉપદ્રવિત કળીઓ

## નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ આ કીટકના નર ફૂંદા "કાળી તુલસી" (ઓસીમમ સેંક્ટમ) ના પાનના રસ તરફ આકર્ષાઈને આવે છે. જેથી કાળી તુલસીના પાનના રસ સાથેની જેરી પ્રલોભીકા "નર આકર્ષક પિંજર"માં રાખી ઉપયોગ કરવાથી આ જીવાતના ઉપદ્રવને ઓછા ખર્ચ કાબૂમાં રાખી શકાય છે. નર આકર્ષક પિંજર બનાવવા માટે પ્લાસ્ટીકની ૧૨ સે. મી. લાંબી અને ૧૦ સે. મી. વ્યાસવાળી ગોળ બરણીમાં તળીયાના મધ્યભાગમાં તથા બરણીના ઢાંકણ ઉપર મધ્યભાગથી સહેજ ઉપર અથવા નીચે ૨.૫ સે. મી. વ્યાસવાળા ગોળ કાણાં પાડવા. પિંજરને લટકાવવા માટે બરણીના વચ્ચેના ભાગે એક નાનું કાણું પાડી તેમાં દોરી બાંધવી. આ પિંજર જમીનથી ૧.૫ થી ૩ મીટરની ઉચ્ચાઈએ રહે તેમ ચીકુના ઝડપની ડાળી પર લટકાવવું. તુલસીના ૫૦૦ ગ્રામ પાનને ઈલેક્ટ્રીક ગ્રાઇનિંગમાં અથવા ખલમાં લસોટી પાનમાંથી નીકળેલા રસમાં ૧ લીટર પાણી ઉમેરી પાતળા કાપડથી ગાળીને મિશ્રણમાં ૨ મી.લી. ડાયકલોરવોસ દવા ઉમેરવી. આ મિશ્રણમાં ૨.૫ × ૨.૫ સે. મી. કદના વાદળીના ટુકડા જબોળી દરેક પિંજરના મધ્યમાં એક ટુકડો મુકવો. એક હેક્ટર વિસ્તારમાં ૮ થી ૧૦ પિંજર લટકાવવા જોઈએ. ઉપરોક્ત મિશ્રણ એક અઠવાડિયા સુધી ઉપયોગમાં લઈ શકાય છે. દરેક પિંજરમાં આંતરે દિવસે વાદળીના ટુકડા પર મિશ્રણ રેડવું. પિંજરમાં નર ફૂંદા આકર્ષાઈ આવશે તે જેરી મિશ્રણના સંસર્ગમાં આવતા મરી જશે. મરી ગયેલા ફૂંદાઓનો વખતો વખત નિકાલ કરવો.

## રાસાયણિક નિયંત્રણ :

- ❖ રાસાયણિક નિયંત્રણ માટે મોજણી કરી ૧૦ ટકા ઉપદ્રવિત કળીઓ જોવા મળે ત્યારે લીમડા આધારીત ૧૫૦૦ પીપીએમ વાળી જંતુનાશક દવા ૩૦ મી. લી. અથવા ડાયકલોરવોશ ૭૬ ટકા દવા ૫ મી. લી. પ્રમાણે ૧૦ લીટર પાડીમાં બેળવીને છંટકાવ કરવો.

## (૨) ચીકુ મોથ :

*Nephopteryx eugraphella* (નેફોટેરીકસ યુગ્રાફેલા)

(Pyralidae : Lepidoptera )

### ઓળખ :

- ❖ પુખ્ત કીટક રાખોડીયા રંગનું હોય છે. તેની અગ્ર પાંખો રાખોડીયા બદામી રંગની સંમિશ્રિત હોય છે જ્યારે પાછળની પાંખો આઢી રંગવિહોણી પીઠા જેવી ધારવાળી હોય છે.
- ❖ ઈયળો ગુલાબી રંગની અને બાજુઓ પર ગુલાબી ભૂખરા રંગના પટ્ટા ધરાવતી હોય છે.
- ❖ પૂર્ણ વિકસીત ઈયળ ર૫ મી. મી. લાંબી હોય છે.
- ❖ મોટી ઈયળ ખૂબ જ ચપળ અને જરા ખલેલ પહોંચે એટલે પાછળ ખસીને રેશમી તાંત્રણા વડે લટકી પડે છે.

### નુકશાન અને જીવનક્રમ:

- ❖ માદા કીટક કૂમળી દુંખો અથવા પાનની નીચેની બાજુએ મધ્યનસ પર ઈડા મૂકે છે. ઈડા અંડાકાર અને પીળાશ પડતા સફેદ રંગના હોય છે. ઈડા અવસ્થા ઉનાળામાં ૨ થી ૪ દિવસની જ્યારે શિયાળામાં ૪ થી ૧૧ દિવસની હોય છે.
- ❖ ઈયળો મુખ્યત્વે પાન ખાઈને નુકશાન કરે છે. આ ઉપરાંત તે ફૂલની ડાંડીઓ, ફૂલો, કળીઓ તેમજ કૂમળા નાના ફળને પણ નુકશાન કરે છે.
- ❖ ઈયળો ચીકુના પાનને ભેગા જોડી દઈ જાળાં બનાવી તેમાં ભરાઈ રહી પાનના હરિતક્રવ્યને ખાઈ જાય છે.
- ❖ ચીકુની નવી ફૂટતી ડાંડીઓ પર જોવા મળતા જાળાં તથા તેમાં કેટલાક સુકા પાંદડાં આ જીવાતના ઉપદ્રવની હાજરી દર્શાવે છે.
- ❖ આ જીવાતનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. પરંતુ જ્યારે નવી કૂપળો ફૂટે અને કળીઓ બેસે ત્યારે ઉપદ્રવ વધુ જોવા મળે છે.
- ❖ સામાન્ય રીતે ઈયળ કળી અને ફૂલની આજુબાજુ રેશમી તાંત્રણાઓ વડે જાળું બનાવી તેમાં ભરાઈને કળી કે ફૂલના નીચેના ભાગમાં કળી કોરનાર ઈયળની સરખામણીમાં મોટુ કાણું પાડીને દાખલ થાય છે. કાણું હધારથી

પુરાઈ જાય છે. આ રીતે કળી કોરનાર ઈયળથી ઉપદ્રવિત કળી કે ફૂલ કરતાં તેનું નુકશાન અલગ પાડી શકાય છે.

- ❖ ઈયળ અવસ્થા ૧૩ થી ૨૬ દિવસની હોય છે. જે દરમ્યાન આશરે ૧૦ થી ૧૪ કળીઓને નુકશાન કરે છે.
- ❖ પૂર્ણ વિકસીત ઈયળ જાળામાં કોશેટો બનાવે છે. કોશેટો અવસ્થા ૮ થી ૧૩ દિવસની હોય છે. આ રીતે જીવાતનો જીવનક્રમ ૨૬ થી ૩૮ દિવસમાં પૂરો થાય છે. જીવાતનો ઉપદ્રવ મે-જુન તેમજ સપ્ટેમ્બરથી નવેમ્બર માસ દરમ્યાન વધુ જોવા મળે છે.

#### અવલોકન પદ્ધતિ :

- ❖ નિયત કરેલ ચીકુવાડીયામાં અસ્તાવસ્ત પદ્ધતિથી ૧૦ ઝાડ પસંદ કરવા.
- ❖ દરેક ઝાડની રેન્ડમ પદ્ધતિથી પાંચ પ્રશાખા પસંદ કરવી.
- ❖ દરેક પ્રશાખા પર ટોચના ૧૦ પાન તપાસી ઉપદ્રવવાળા પાન નોંધવા.

#### અવલોકન નોંધ :

ઝાડ નંબર	પ્રશાખા પર ઉપદ્રવિત પાનની સંખ્યા					કુલ
	૧	૨	૩	૪	૫	
૧	કુલ ૫૦૦ પાનમાંથી ઉપદ્રવિત પાનની સંખ્યાનો સરવાળો કરી ઉપદ્રવિત પાનની ટકાવારી કાઢી જે					
૧૦	સંખ્યા આવે તેને પૂર્ણાંક સંખ્યામાં ફેરવી તેનીનોંધ અવલોકન કરીએ કરવી.					
કુલ :						

ઉપદ્રવિત પાનના ટકા : .....

ક્ષમ્યમાત્રા : ૨૦ ટકા ઉપદ્રવિત પાન

#### નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ આ જીવાતના નિયંત્રણ માટે ઉપદ્રવિત પાનના જુમખા ઈયળ સહિત તોડીને નાશ કરવો.

(અ) પાનની મધ્યનસથી ધાર વાળનાર ઈયળ : (Midrib folder)

*Banisia myrsusales elaralis* (બેનીસીયા માયરસ્યુસેલ્સ ઈલારેલીસ)

(Thyrididae : Lepidoptera)

ઓળખ :

- ❖ પુખ્ત કીટક બદામી રંગનું અને પ્રસરેલી પાંખો સાથે તેની પહોળાઈ ૨૧ થી ૨૮ મી. મી. જેટલી હોય છે. અગ્ર પાંખના મધ્યે જાંખા સફેદ રંગના ટપકાં જોવા મળે છે. નર કીટકના ઉદરની ટોચ અણીવાળી જ્યારે માદા કીટકના ઉદરની ટોચ બુઝી હોય છે.
- ❖ પૂર્ણ વિકસીત ઈયળ આછા લીલાશ પડતા રંગની અને બન્ને બાજુઓ પર બદામી રંગના ટપકાં ધરાવતી ૧૫ થી ૨૦ મી. મી. લંબાઈની હોય છે.

#### નુકશાન :

- ❖ માદા કીટક કળી કે કૂમળા પાન પર એકલ દોકલ ઈડા મૂકે છે.
- ❖ નાની ઈયળ શરૂઆતમાં કૂમળાં પાનને મધ્યનસથી કોતરી ખાય છે.
- ❖ બીજી, ત્રીજી અને ચોથી અવસ્થાની ઈયળો પાનને મધ્યનસથી વાળી દઈ બે ધારો વચ્ચે જાળું બનાવે છે. ઈયળ આવા વાળેલા પાનમાં જ રહીને પાનના હરિતક્રવ્ય ખાઈને નુકશાન કરે છે.
- ❖ એક વાળેલા પાનમાં એક જ ઈયળ જોવા મળે છે. પરંતુ ઈયળ નુકશાન કરેલ પાનમાં કાણું પાડીને બહાર નીકળી બીજા પાનને નુકશાન કરે છે.
- ❖ આમ ઈયળ તેની ૧૨ થી ૧૪ દિવસની અવસ્થા દરમ્યાન ૫ થી ૧૦ પાનને નુકશાન કરે છે.
- ❖ આ જીવાતનો વધુ પડતો ઉપક્રવ હોય તો બધી જ કુંપળો સુકાઈ જાય છે. જેને દૂરથી ઓળખી શકાય છે.
- ❖ આ જીવાત જમીનમાં અથવા પાન પર રતાશ પડતા બદામી રંગનો કોશોટો બનાવે છે.
- ❖ સામાન્ય રીતે આ જીવાતનો ઉપક્રવ એપ્રિલથી જુન તેમજ સપ્ટેમ્બરથી નવેમ્બર દરમ્યાન વધુ જોવા મળે છે.

#### (૪) પાનકોરીયુઃ :

*Acrocercops gemoniella* (એકોસરકોપ્સ જીમોનીયેલા)

(Gracillariidae : Lepidoptera)

- ❖ આ કીટકની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે.
- ❖ ઈડામાંથી નીકળેલી ઈયળ કૂમળા પાનના બે પડ વચ્ચે દાખલ થઈ અંદરની પેશીઓ ખાઈ પાન પર સર્વકાર પારદર્શક રેખાઓ ઉપસાવે છે.
- ❖ આ ઉપરાંત ઈયળ પાનના ડીટા તરફથી ધારવાળી તેમાં ભરાઈને પાનના હરિતક્રવ્ય ખાઈને નુકશાન કરે છે જેથી પાનની ધારવાળનારી ઈયળ તરીકે પણ ઓળખાય છે. કોશોટો વાળેલ પાનની ધારની અંદર બનાવે છે.
- ❖ આ જીવાતનો ઉપક્રવ ખાસ કરીને જુન થી સપ્ટેમ્બર દરમ્યાન જોવા મળે છે.

### અવલોકન પદ્ધતિ :

- ❖ નિયત કેરલ ચીકુવાડીયામાં અસ્તવ્યસ્ત પદ્ધતિથી ૧૦ ઝડ પસંદ કરવા.
- ❖ દરેક ઝડની રેન્ડમ પદ્ધતિથી પાંચ પ્રશાખા પસંદ કરવી.
- ❖ દરેક પ્રશાખા પર ટોચના ૧૦ પાન તપાસી ઉપદ્રવવાળા પાન નોંધવા.

### અવલોકન નોંધ:

જાડ નંબર	પ્રશાખા પર ઉપદ્રવિત પાનની સંખ્યા					કુલ
	૧	૨	૩	૪	૫	
	અવલોકન નોંધ ચીકુ મોથમાં દર્શાવ્યા મુજબ કરવી.					
કુલ :						

ઉપદ્રવિત પાનના ટકા : .....

ક્ષમ્યમાત્રા : ૧૦ ટકા ઉપદ્રવિત પાન

### નિયંત્રણ વ્યવસ્થાપન :

#### (૫) ચીકુની ફળમાખી :

- ❖ આંખાના પાકમાં નુકશાન કરતી ફળમાખી ચીકુના પાકમાં પણ નુકશાન કરે છે.
- ❖ આ જીવાતનો ઉપદ્રવ મે મહિનામાં વધારે જોવા મળે છે.
- ❖ આંખાની ફળમાખીમાં દર્શાવ્યા મુજબ નિયંત્રણના પગલાં હાથ ધરવાથી ચીકુની ફળમાખીનું પણ નિયંત્રણ થઈ શકશે.

#### (૬) ચીકુના બીજ ખાનારી ઈયળ :

*Trymalitis margarias* Meyrick (ટ્રાયમેલિટિસ મારગારીસ)

(Tortricidae : Lepidoptera )

### ઓળખ :

- ❖ ફુંદા મેલા સફેદ રંગના અને પાંખ પર રાખોડી રંગના ટપકાં તથા આગલી પાંખ પર ભૂખરા રંગનો પટ્ટો જ્યારે પાછલી પાંખ મેલા સફેદ રંગની અને જાલરવાળી હોય છે.
- ❖ ઈયળ આશરે ૧૨ થી ૧૭ મી. મી. લાંબી અને ઘેરા લાલ રંગની હોય છે.

### નુકશાન :

- ❖ ઈયળ મધ્યમ કદના ફળમાં કાણું પાડી અંદર દાખલ થાય છે અને વિકસતા બીજ સુધી પહોંચે છે ત્યારબાદ બીજમાં દાખલ થઈ બીજ કોરી ખાઈને ઈયળ અવસ્થા પુરી કરે છે અને પછી ફરીથી ફળમાં કાણું પાડી બહાર આવી કૂમળા પાન પર કોરોટો બનાવે છે.

- ❖ આમ ફળોનો બજારભાવ ઓછો મળતાં આર્થિક રીતે મોટું નુકશાન થાય છે. સામાન્ય રીતે ચોમાસુ પુરુ થતાં ઉપદ્રવ શરૂ થાય છે અને ફેબ્રૂઆરી સુધીમાં ૧૦ થી ૫૦ ટકા જેટલું નુકશાન પહોંચાડી શકે છે.

#### નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ ઓક્ટોબર—નવેમ્બર માસમાં ૨૫ દિવસના આંતરે પ્રોફેનોફોસ ૫૦ ટકા ઈસી ૧૫ મી.લી. લેમડા સાયહેલોશ્રીન ૫ ટકા ઈસી ૧૦ મી.લી. અથવા પ્રોફેનોફોસ ૪૦ ટકા + સાયપરમેશ્રીન ૪ ટકા ઈસી ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

#### (૭) ચીકુની ઘોડીયા ઈયળ :

*Achaea mercatoria* (એકીયા મરકેટોરીયા)

(Noctuidae : Lepidoptera )

#### ઓળખ :

- ❖ ઝુંદા બદામી રંગના અને નીચેની પાંખ ઉપર બદામી અને સફેદ રંગના ઘાબાંવાળી હોય છે.
- ❖ ઈયળ મજબૂત, લીસી, ૪.૫ સે. મી. લાંબી, રાખોડી ભૂરા રંગની અને પીઠ ઉપર જાંખા બદામી રંગના પઢ્યાવાળી હોય છે.

#### નુકશાન :

- ❖ ઈયળ શરૂઆતમાં કૂમળા પાન અને પાછળથી દરેક પ્રકારના પાન કાપીને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે.
- ❖ ઉપદ્રવ વધુ હોય ત્યારે ડાળીની ટોચના પાન પર ફક્ત મધ્યનસ જોવા મળે છે.

#### નિયંત્રણ વ્યવસ્થાપન :

- ❖ આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય ત્યારે કલોરપાયરીફોસ ૫૦ ટકા + સાયપરમેશ્રીન ૫ ટકા ઈસી ૧૦ મી.લી. અથવા લેમડા સાયહેલોશ્રીન ૫ ટકા ઈસી ૧૦ મી.લી. અથવા કાર્બોસલ્ફાન ૫૦ ટકા ઈસી ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

#### (૮) કાતરા : *Metanastria aconyta* (મેટાનાસ્ટ્રીયા એકોનીટા)

(Lasiocampoidae :Lepidoptera)

- ❖ ઝુંદા મોટા કદના અને બદામી રંગના હોય છે.
- ❖ ઈયળ માંસલ, લાંબી આશરે ૭ થી ૮ સે. મી. લાંબી અને તેના શરીર પર લાંબા ઘેરા બદામી રંગના વાળ હોય છે. ઈયળો મોટી સંઘ્યામાં પાન ખાઈને નુકશાન કરે છે. ઈયળો રાત્રીના સમયે જાડની ડાળી પર સમૂહમાં ચોટી રહે છે.

### **નિયંત્રણ વ્યવસ્થાપન :**

- ❖ આ જીવાતનો ઉપદ્રવ કયારેક છુટો છવાયો જોવા મળે છે તેથી ઈયળોને હાથથી વીણીને નાશ કરવો.

### **અન્ય જીવાતો :**

**થડનો મેઠ :** આ જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે ૫ થી ૧૦ વર્ષના જાડમાં જોવા મળે છે.

- ❖ પુખ માદા ક્રીટક ડાળીની છાલના ટોચના ભાગમાં ઈડા મૂકે છે. ઈડામાંથી નીકળતી ઈયળ છાલની નીચે કોરાણ કરી જમીન સુધી પહોંચે છે. પરિણામે જાડ મરી જાય છે.

### **નિયંત્રણ વ્યવસ્થાપન :**

- ❖ શક્ય હોય તો ઈયળને બહાર કાઢીને નાશ કરવો. ઉપદ્રવિત છાલ કોતરી કાણાંમાં કલોરપાયરીઝોસ ૨૦ ટકા ઈસી ૧૦ મી. લી. + ડાયકલોરવોસ ૭૬ ટકા ૫ મી. લી. દવા ૧ લીટર પાણીમાં ભેળવી મોટા ઈન્જેક્શનથી દાખલ કરી કાણું ભીની માટીથી બંધ કરી દેવું.

### **ભીગડાવાળી જીવાત :**

- ❖ આ જીવાતનો ઉપદ્રવ નવી કુંપળોની ડાળી તેમજ પાન પર જોવા મળે છે. બચ્ચાં અને માદા ક્રીટક સતત રસ ચૂસીને નુકશાન કરતાં કયારેક જોવા મળે છે.

### **ચીકટો :**

*Drosicha mangiferae* (ક્રોસીકા મેન્ગિફરે)

(Margarodidae :Hemiptera)

- ❖ આ જીવાતના બચ્ચાં અને માદા ક્રીટક કૂમળી ડાળીઓ, ફળના ડીંચા આગળ સ્થાયી થઈને સતત રસ ચૂસીને નુકશાન કરતા જોવા મળે છે.



૨.૧ આંબાના પાન પર થીપ્સ



૨.૨ આંબામાં થીપ્સનું નુકશાન




૪.૧ આંબાના મેઢનું પુખ્ત કીટક



૪.૨ આંબાના મેઢના પુખ્ત કીટકો



૪.૩ આંબાના મેઢનું પુખ્ત કીટક




૪.૪ આંબાના થડમાં મેઢનું કોરાણ



૪.૫ પુર્ણ વિકસીત આંબાનો મેઠ (ઇથળ)




૪.૬ આંબાના મેઢનું નુકશાન



૫.૧ કેરી પર ચીકટોનો ઉપદ્રવ






૫.૨ આંબાના થક પર  
પોલિથિન શીટ નો પડ્ઝો



૫.૧ કેરીના ગોટલાના ચાંચવા (પુષ્ટ કીટકો)



૫.૨ કેરીના ગોટલાનું ચાંચવું  
(પુષ્ટ કીટક)



૫.૩ કેરીના ગોટલામાં ચાંચવાનું નુકશાન



૭.૧ આંબામાં ફૂંખ વેદકનું નુકશાન



૭.૨ આંબાના પુષ્પ વિન્યાસમાં ફૂંખ વેદકનું નુકશાન





૮.૧ રાતી કીડીની રાણી



૮.૨ અંબાના પાન પર રાતી કીડીનું નુકશાન



૮.૩ રાતી કીડીનો ભાગો




૯.૧ અંબાના પાન પર  
ગાંઠીયા માખીનું નુકશાન



૧.૧ ચીકુ બડ બોરણા પુષ્ટ કીટકો



૧.૨ ચીકુની બડ બોરણની દીથળ




૧.૩ ચીકુની કળીમાં બડ બોરણનું નુકશાન






૨.૧ ચીકુ મોથના પુખ્ત કીટકો



૨.૨ ચીકુની ફળમાં ચીકુ મોથનું નુકશાન



૨.૩ ચીકુના ફળમાં ચીકુ મોથનું નુકશાન



૩.૧ મીડ રીબ ફોલરના પુખ્ત કીટકો



૩.૨ ચીકુમાં મીડ રીબ ફોલરનું નુકશાન



૩.૩ ચીકુના પાનકોરિયાનું નુકશાન

## ચીકુના બીજ ખાનારી ઈયળ



૬.૧ પુષ્ટ કીટકો




૬.૨ બીજમાં ઈયળનું કોરાણ




૬.૩ પૂર્ણ વિકસિત ઈયળ



૬.૪ કોશોટો



૬.૫ ફળમાથી પૂર્ણ વિકસિત ઈયળ  
બહાર નીકળતા પડેલા કાણાં



૬.૬ બીજમાંથી ઈયળ બહાર નીકળતા પડેલું કાણું





૨.૧ આંબાનો કાલપ્રણા



૨.૨ આંબાનો કાલપ્રણા મોર પર



૨.૩ આંબાનો કાલપ્રણા નાના ફળ પર



૨.૪ આંબાનો કાલપ્રણા પાકા ફળો પર



૩.૧ આંબાની વાનરૂપતિક



૩.૨ આંબાની ફુલની વિકૃતિ



૪.૧ આંબાનું અપરોહ મૃત્યુ



૫.૧ આંબાનો કાણી ડાણીનો રોગ

## આંબાનો ભૂકી છારો



૧.૧ આંબાનો ભૂકી છારો પાન પર



૧.૨ આંબાનો ભૂકી છારો મોર પર




૬.૧ આંબાનો શ્વામ છારો




૭.૧ આંબાનો ભૂખરો ઝાળ



૮.૧ આંબાના પાનની ટોચનો ઝાળ (લિફ ટીપ બલાઇટ)




૯.૧ આંબાનો વાંદો



૧.૧ ચીકુના પાનના ટપકાનો રોગ



૧.૨ ચીકુના પાનના ટપકાનો રોગ



૩.૧ ચીકુનો વાંદો



## ડૉ. એ.એન. સાબલપરા, ડૉ. કે. યુ. સોલંકી, ડૉ. એમ. બી. પટેલ, ડૉ. જી. જી. રાદીયા અને શ્રી એસ. કે. ચાવડા

આંબા ગુજરાતનો તથા ભારતનો ખૂબજ મહત્વનો ફળપાક છે. કેરી ભારતના દરેક વિસ્તારનું ખૂબ જ પ્રિય ફળ હોવાથી તેને ફળોનો રાજ તરીકે ઓળખવામા આવે છે. આ પાક છેલ્લા ૪૦૦૦ વર્ષોથી ભારતમાં ઉગાડવામાં આવે છે. આ ફળ ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ સહેલાઈથી પ્રાય હોવાથી લોકપ્રિય છે.

આ પાક ભારતમાં લગભગ ૧૫ લાખ હેક્ટર વિસ્તાર માં ઉગાડાય છે, જે ફળ પાકના વિસ્તારનો ૭૦% જેટલો થાય છે. ભારતભરમાં લગભગ ૧૦૦૦ કરતા પણ વધારે આંબાની જાતો ઉગાડાય છે પરંતુ અમુક જ જાતો વ્યાપારી ઘોરણે જુદા જુદા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. આપણો દેશ વિશ્વના ૬૦% જેટલી કેરીનું ઉત્પાદન કરતો હોવા છી કેરીની નિકાસમાં ચોથું સ્થાન ધરાવે છે જેની પાછળનું મુખ્ય કારણ નબળી ગુણવત્તા છે. ગુણવત્તામાં રોગ અગત્યનો ભાગ ભજવે છે. આ પાકમાં લગભગ ૧૫૫ જેટલો રોગો આપણા દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નોંધાયા છે જે કેરીના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર સીધી અસર કરે છે. કયારેક આખી વાડી જે ધણી મહેનત અને ખર્ચ કરીને બનાવેલી હોય તેના જાડ કાઢી નાંખવા પડે છે. આ પાકમાં મુખ્યત્વે ફૂગ, બેકટેરિયા અને આલ્ગીથી થતા રોગો જોવા મળે છે. જેમાં મુખ્યત્વે ભૂકી છારો, કાલવ્રણ, વિકૃતિ, કાળી ડાળીનો રોગ, અવરોધ મૂત્ય, ફળના સડા, પાનનાં ટપકા, પાનનો ઝાળ, તામ્ર ગેરુ તેમજ વાંદો જોવા નુકશાનકારક રોગો અગત્યના છે.

### ૧. ભૂકી છારો (પાવડરી મીઠદય) (૨૮)

**વ્યાવિજન :** *Oidium mangiferae* (ઓઇડિયમ મેન્જીફેરી) નામની ફૂગથી આ રોગ થાય છે.

આંબામાં ભૂકી છારો એક ખૂબજ ગંભીર પ્રકારનો રોગ છે જે લગભગ બધીજ જાતોમાં જોવા મળે છે. આ રોગની તીવ્રતા મુખ્યત્વે વાતાવરણના પરિબળો પર આધાર રાખે છે. આ રોગની સીધી અસર કેરી બેસવાની તેમજ ફળોના વિકાસ પર થતી હોવાથી સાનુકૂળ વાતાવરણમાં ૬૦ % જેટલું નુકશાન થઈ શકે છે.

#### રોગની ઓળખ :

- આ રોગ સામાન્ય રીતે ડીસેમ્બર થી માર્ચ મહિના દરમાન જ્યારે આંબામાં મોર નીકળે છે ત્યારે જોવા મળે છે.
- રોગની શરૂઆતમાં મોરની દાંડી પર સફેદ છારીના ધાબા જોવા મળે છે જે પાછળથી બદામી રંગના થાય છે.
- આ રોગના આક્રમણથી ફલિનીકરણ થાય તે પહેલા અથવા તે પછી કૂમળો મોર સુકાઈને ખરી પડે છે.
- અસરગ્રસ્ત મોરનો ભાગ સુકાઈને ભૂખરો થઈ જાય છે.
- રોગનું પ્રમાણ વધતા નાના ફળ, કૂમળા પાન તેમજ પર્શાદંડ પર છારી દેખાય છે.

- સામાન્ય રીતે રોગનો પ્રભાવ આંબાના મોર પર વધુ જોવા મળે છે. પણ કેટલીક વખત નવા વિકાસ પામતા પાનની પાછળની બાજુએ સફેદ ફૂગની છારી જોવા મળે છે.
- રોગગ્રસ્ત પાન વિકૃત અને વળી ગયેલા જણાય છે આ રોગમાં મોર તેમજ નાના મરવા ખરી પડતા હોવાથી મહત્વમનુકશાન થાય છે.

### **સાનુકુણ પરિબળો :**

- આ રોગને સુકુ અને ઠંડુ વાતાવરણ ખૂબજ માફક આવે છે.
- સામાન્ય રીતે મોર ફૂટે ત્યારે ખાસ કરીને ડીસેભર-જાન્યુઆરી માસમાં આવુ હવામાન હોય ત્યારે રોગનું આક્મણ થાય છે અને તેનો ફેલાવો જરૂરી બને છે.

### **નિયંત્રણ :**

- આંબાવાડીમાં સૂકા ડાળા, પાન, ફળ વિગેરે એકઠા કરી બાળીને તેનો નાશ કરવો.
- આંબાવાડીમાં નિંદામણ કરતા રહેવું.
- આંબાવાડીમાં રાસાયણિક ખાતરો તેમજ પિયત માફકસરના ભલામણ મુજબ આપવા.
- મોર નીકળવાની શરૂઆત થાય અને કળીઓ ખીલતી હોય ત્યારે આગામયેતીના ભાગરૂપે (પ્રોટેક્ટીવ મેજસ) વેટેબલ સંફર ૫૦% વે. પા. ૩૦ ગ્રા. ૧૦ લી. પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
- ફૂલ ખીલી ગયા હોય ત્યારે ભૂકી છારો જણાય તો ડીનોકેપ ૪૮ ઈ. સી. ૧૦ મિ. લિ. અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મિ. લિ. અથવા થાયોફેનેટ મીથાઈલ ૭૦% વે. પા ૫ ગ્રામ અથવા કાર્બોન્ડાજીમ ૫૦% વે. પા. ૫ ગ્રામ અથવા ટ્રાયડેમોઝ ૮૦ ઈ. સી. ૫ મિ. લિ. અથવા પેનકોનાઝોલ ૧૦ ઈ. સી. ૫ મિ. લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
- ફળ બેસવા માંડે ત્યારે દવા છંટવાની જરૂર પડેતો ફરી વેટેબલ સંફર દવા છાંટી શકાય અથવા રોગનું આક્મણ વધારે હોય તો ઉપરની કોઈપણ દવા છાંટી શકાય.
- જ્યારે હવામાન મિશ્ર પ્રકારનું હોય અને ભૂકીછારા અને કાલવણ બન્ને અને અન્ય પાનના રોગો હોય તો કાર્બોન્ડેજીમ અથવા થાયોફેનેટ મીથાઈલ ઉપર પ્રમાણે છાંટી શકાય.

### **અવલોકન પદ્ધતિ :**

આંબાવાડીયામાં ૧૦ ઝડ પસંદ કરી દરેક ઝડ ની ફરતે અસ્તવ્યસ્ત રીતે ૧૦ મોરની દાંડી પસંદ કરી ટેગ બાંધવી. ત્યારબાદ નીચે આપેલ તીવ્રતા મુજબ આંક આપી કોઠામાં અવલોકનો દર્શાવી સુત્ર પ્રમાણે સરેરાશ રોગનો આંક કાઢવો.

રોગનો આંક	રોગની તીવ્રતાનું વર્ણન
૦	રોગમુક્ત
૧	૧ થી ૨૦ % રોગવાળો વિસ્તાર (કુલની દાંડી ઉપર આશરે ૧ થી ૧૦ ધાબા)
૨	૨૧ થી ૪૦% રોગવાળો વિસ્તાર (કુલની દાંડી ઉપર આશરે ૧૧ થી ૨૦ ધાબા)
૩	૪૧ થી ૬૦ % રોગવાળો વિસ્તાર (કુલની દાંડી ઉપર આશરે ૨૧ થી ૪૦ ધાબા એટલે કે ૨/૩ ભાગ રોગની અસરવાળો)
૪	૬૧ થી ૮૦% રોગવાળો વિસ્તાર (કુલની દાંડી ઉપર ૨/૩ થી વધુ રોગની અસરવાળો ભાગ કે જે બદામી દેખાય )
૫	૮૧ થી ૧૦૦% રોગવાળો વિસ્તાર (કુલની દાંડી ઉપર તુ/૪ થી વધુ રોગની અસરવાળો મોર સુકાઈ જાય)

અવલોકન નોંધવાનો કોઠો :

જાડ નંબર	રોગનો આંક (૧૦ મોરની દાંડી ઉપર)									
(૧)	૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦
(૧૦)	કુલ રોગનો આંક સરેરાશ રોગનો આંક									

સરેરાશ રોગ આંક :	<u>કુલ રોગનો આંક</u>	x ૧૦૦
	કુલ જોયેલ મોર ની દાંડીની સંખ્યા x મહત્વમાં રોગ આંક	

## ૨. કાલવ્રષા /કાળયો (અન્ધે કનોઝ) (૨૮)

વ્યાધિજન : *Colletotrichum gloeosporioides* (કોલેટોટ્રાયકમ ગ્લીઓસ્પોરોઇડસ) નામની ફૂગથી આ

રોગ થાય છે.

ભારતમાં આ રોગ ૧૯૨૪ માં સૌ પ્રથમવાર નોંધાયો હતો. આ રોગ આંબાવાડિયામાં તેમજ કેરી ઉતાર્યા પછી પણ આવે છે અને ખૂબજ નુકશાન કરે છે. આ રોગ પાન, ડાળીઓ અને ફળો પર જોવા મળે છે. આ રોગ આંબાવાડિમાં બારેમાસ કોઈને કોઈ સ્વરૂપે જોવા મળે છે. લગભગ આંબાના મૂળ સિવાયના બધાજ ભાગો પર તેનું આક્રમણ થઈ શકે છે. આ રોગથી આંબાવાડીયાના ઝાડ નભળા પડે છે. ઘણી વખત વાડી કાઢી નાખવાના પ્રશ્નો ઉદ્ભવે છે. તે ઉપરાંત પાકી કેરીઓ સરી જાય છે આથી કેરીની નિકાસને ખાસ અસર કરે છે.

## રોગની ઓળખ :

- આ રોગ મુખ્યત્વે કુમળી ડાળીઓ, મોટી ડાળીઓ, પુષ્પગુચ્છ (મોર) તેમજ નાના ફળો (મરવા) અને પાકી કેરીમાં જોવા મળે છે.

- આ રોગમાં કૂમળા પાન ઉપર ગોળાકાર, બદામી કે ધાટા કથ્થઈ રંગના દબાયેલા ટપકાં જોવા મળે છે. આવા ટપકાંનો વચ્ચેનો ભાગ ઘણીવાર ખરી પડે છે ત્યારે પાનમાં કાણા પડેલા દેખાય છે.
- પાનની કિનારી બદામી કે કાળી થઈ ઘણીવાર સુકાઈ જાય છે.
- અનુકૂળ વાતાવરણમાં કુંપળ સાથે કુમળી ડાળીઓ પણ ચીમળાઈ જઈ ટોચથી સુકાઈ જાય છે.
- રોગગ્રસ્ત પુષ્પ ગુચ્છ ની દાંડી પર શરૂઆતમાં કાળા, પાણી પોચા દબાયેલા ડાઘા પડે છે. કૂલો પણ કાળા પડી સુકાય જાય છે અને આખરે આવા કૂલો ખરી પડે છે.
- આ રોગની અસરને પરિણામે નાના મગીયા કે મરવા ડીટના ભાગેથી ખરી પડે છે. કેટલાક મરવા સુકાઈને કાળા પડી જઈને ડાળીઓ સાથે ચોટીને રહેલા જોવા મળે છે જેથી આ રોગને કાળીયો તરીકે ઓળખવામાં આવે છે.
- કેરી ઉતારી લીધા બાદ તેની હેરફેરથી થતા જખમો અને ડીચા મારફતે ફળોમાં રોગનો ચેપ દાખલ થાય છે. ફળો ઉપર ધાંટા બદામી રંગના કે કાળા પોચા ધાબા પડે છે અને કેરી સડવા માંડે છે.

### સાનુકૂળ પરિબળો :

- હુંકાળું ભેજવાળું વાતાવરણ ખૂબ અનુરૂપ આવે છે.
- સાંકડા અંતરે વાવેતર કરેલી વાડીમાં તેમજ જ્યાં વધુ પડતું પિયત આપવામાં આવતું હોય અથવા નીચાણવાળી કે ઓછી નિતાર શક્તિ ધરાવતી જમીનમાં આ પ્રશ્ન વધુ રહે છે.

### નિયંત્રણ :

- કેરી ઉતારી લીધા પછી વાડીમાં નીચે પડેલા રોગિષ્ટ પાન, ડાળી કે ફળો વીણીને તેનો નાશ કરવો.
- જાડ પરથી સુકાયેલી રોગગ્રસ્ત ડાળીઓની છંટણી કરી, જખમ વાળા ભાગ ઉપર બોર્ડપેસ્ટ (મોરથુથુ ૧ કિ. ગ્રા. + કળી ચૂનો ૧ કિ. ગ્રા + ૧૦ લિટર પાણી) લગાડવી અથવા બોર્ડમિશ્રણ ૦.૮% (મોરથુથુ ૮૦ ગ્રામ + કળી ચૂનો ૮૦૦ ગ્રામ + ૧૦ લિટર પાણી) ના દ્વારણાનો છંટકાવ કરવો.
- માફકસરનું ભલામણ મુજબનું પિયત તેમજ રાસાયણિક ખાતર આપવું.
- વાડી ખૂબ જૂની હોય અને ડાળીઓ એકબીજામાં મળી ગઈ હોય તો છંટણી કરી બોર્ડો પેસ્ટ લગાડવી.
- કેરી (ફળો) બની શકે તો ડીચા સાથે ઉતારવા તેમજ તેને કોઈ જખમો પડે નહીં તેની કાળજી રાખવી.
- કેરી ઉતાર્યા પછી ફળના સડાના નિયંત્રણ માટે ફળોનું પેકિંગ કરતા પહેલા ૫૧ ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીમાં ૧૫ મીનીટ સુધી દૂબાડી રાખી ગરમ પાણીની માવજત આપવી.

### અથવા

૫૫ ડિગ્રી સે. ગરમ પાણીમાં બાવિસ્ટન અથવા બેનોમિલ (૦.૧%) ઉમેરીને ફળોને ૫ મિનિટ સુધી દૂખાડી રાખવા. આમ કરવાથી કેરીમાં સડાનું પ્રમાણ નહીંવત રહેશે.

### અવલોકન પદ્ધતિ :

આંબાવાડીયામાં ૧૦ જાડ પસંદ કરી દરેક જાડ ની ફરતે અસ્તવ્યસ્ત રીતે ૧૦ મોરની દાંડી પસંદ કરી ટેગ બાંધવી. ત્યારબાદ નીચે આપેલ તીવ્રતા મુજબ આંક આપી કોઈમાં અવલોકનો દર્શાવી સુત્ર પ્રમાણે સરેરાશ રોગનો આંક કાઢવો.

### અવલોકન નોંધવાનો કોઠો :

રોગનો આંક	રોગની તીવ્રતાનું વર્ણન
૦	રોગમુક્ત
૧	૧ % વિસ્તાર રોગવાળો
૨	૧.૧ થી ૧૦% વિસ્તાર રોગવાળો
૩	૧૦.૧ થી ૨૫% વિસ્તાર રોગવાળો
૪	૨૫.૧ થી ૫૦% વિસ્તાર રોગવાળો
૫	૫૦% વધુ વિસ્તાર રોગવાળો

જાડ નંબર	રોગનો આંક (૧૦ મોરની દાંડી / પાન ૫૨)									
	૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦
(૧)										
(૧૦)										
કુલ રોગનો આંક										
સરેરાશ રોગનો આંક										

સરેરાશ રોગ આંક : કુલ રોગનો આંક x ૧૦૦  
કુલ જોયેલ મોર ની દાંડીની સંખ્યા x મહત્વમાં રોગ આંક

### ૩. વિકૃતી (માલફોર્મેશન) (૩૦)

**વ્યાધિજન :** *Fusarium moniliformae* (ફ્યુસેરિયમ મોનિલિફોર્મ)

ફ્યુસેરિયમ મોનિલિફોર્મ નામની ફૂગથી થાય છે અને તેનો ફેલાવો પાનકથીરી (માઈટ)થી થાય છે. તેમજ દુનિયાના દેશોની એક વિકટ સમસ્યા છે. સૌ પ્રથમ આ રોગ ૧૮૮૧ માં બિહારના દરભંગા જીલ્લામાં જોવા મળ્યો હતો. આ રોગ ઉત્તર ભારતમાં સામાન્ય રીતે જોવા મળતો પરંતુ છેલ્લા ૫-૭ વરસ થી દક્ષિણ ગુજરાત તેમજ અન્ય વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ રોગમાં મુખ્યત્વે બે પ્રકારની વિકૃતિઓ જોવા મળે છે.

## ૧. વાનસ્પતિક વિકૃતિ :

(અ) કલમ પરના ગુમખીયા પાન : આંબાની કલમો પર ટોચના ભાગે અસંખ્ય નાના પણોનો ગુચ્છો/દડો જોવા મળે છે. આવી કલમો આંબાવાડિયામા રોપવા માટે પસંદ કરવી નહીં.

(બ) ઝડ પરની વિકૃતિ : આ રોગમાં આંબાની ડાળીના ટોચના પાન શરૂઆતમાં જાડા, પાતળા, ટૂંકા અને દળદાર બને છે. પાન તેની કુદરતી લક્ષણિકતા ગુમાવે છે. નવો ફાલ આવતા ડાળીઓ ગુચ્છામાં ફૂટે છે. પાન નાના અણીદાર એકત્રિત રીતે ગુચ્છામાં ગોઠવાયેલા હોય છે જે કંઈક અંશે વિકૃત બની જાય છે. આ રોગ જો નાની કલમો અથવા નવી વાડીમાં દેખાય તો ઝડ કાઢી નાંખવુ પડે છે. તે ઝડ સારી રીતે ઉછેરી શકાતુ નથી. અને મોટા ઝડમાં આવે તો ડાળીઓ ધીમે નબળી પડી બિન ફળાઉ થઈ જાય છે. આથી આ રોગથી ઘણું નુકશાન થાય છે.

## ૨. ફૂલની વિકૃત :

આ વિકૃતિમાં ફૂલો જાડા તેમજ ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પુષ્પવિન્યાસ નીકળે છે. વિકૃત પુષ્પવિન્યાસમાં ફૂલો થોડા વધારે પ્રમાણમાં પરંતુ પરાગરજ પ્રમાણમાં ઘણીજ ઓછી હોય છે. તેમજ આ રોગમાં સારા ફૂલોનું પ્રમાણ નહીંવત હોય છે તેમજ વધારે પ્રમાણમાં પાંદરીઓ હોય છે અને પાંદડા જેવું દેખાય છે. ફળો બેસતા નથી. દૂરથી જોતા ઝડ ઉપર કોબીફ્લાવરના દડા જેવા ગુચ્છ જોવા મળે છે. આ રોગ એક વર્ષ આવ્યા પછી બીજા વર્ષ આવશેજ તેમ થતુ નથી.

## સાનુકૂળ પરિબળો :

- ફૂલ બેસવાની અવસ્થાએ જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોવુ.
- શિયાળાના સમય દરમ્યાન જ્યારે સરેરાશ તાપમાન ૧૦ થી ૧૫ ડીગ્રી સે. હોય ત્યારે વિકૃતિ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

## નિયંત્રણ :

- પ્રમાણિત તંદુરસ્ત અને રોગમુક્ત કલમો વાવેતર માટે પસંદ કરવી.
- રોગિષ્ટ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની છંટણી કરી બાળીને નાશ કરવો.
- આ રોગિષ્ટ ભાગ પાછળનો ૧૫ સે. મી. જેટલો તંદુરસ્ત ભાગ પણ સાથે છંટણી કરવો ત્યાર બાદ ડાળી કાપેલ હોય ત્યાં બોર્ડ પેસ્ટ લગાડવી.
- કાર્બન્ડેજીમ ૫૦% વે. પા, ૫ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

- આ જ દવાનું પ્રમાણ બનાવી જાડની ઉમરને ધ્યાનમાં લઈ ૧૦ થી ૧૫ લિટર પ્રમાણે થડની ફરતે જમીનમાં રેડવું.
- કૂલ આવવાની શરૂઆત થાય ત્યારે બાહ્ય લક્ષણો પરથી વિકૃતિ ઓળખી તેના પુષ્પવિન્યાસનો નાશ કરવો.
- મૂલકંડ માટે જે જાડ આવી વિકૃતિઓથી મુક્ત હોય તેવા જાડના જ ગોટલા પસંદ કરવા.
- ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં નેઘેલીન એસેટિક એસિડ ( એન. એ. એ.) ૨ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
- શિયાળાના સમયમાં આ રોગનું પ્રમાણ વધતું હોવાથી આ સમય દરમ્યાન કૂલોનો સમય થોડો મોડો કરવા માટે જીથ્રેલિક એસિડ ૦.૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જેથી કૂલોનું પ્રમાણ વધે. જીથ્રેલિક એસિડનું વધુ પ્રમાણ રોગમાં વધારો કરતું હોવાથી યોગ્ય પ્રમાણ જાળવવું.
- ચાર વર્ષ સુધી સતત વિકૃતિવાળા ગુચ્છ કાપી નાખી ડાયાજીનોન ૫૦ ઈસી ૨૦ મિ. લિ. અથવા ફોસ્ફામીડોન ૪ મિ. લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- વિકૃતિ અને બીજા રોગોથી મુક્ત હોય તેવા જાડો જ કલમ બનાવવા માટે પસંદ કરવા.
- કલમો તેયાર કરતા તેમજ કેરીનું ઉત્પાદન કરતા બેદૂતોને આ રોગના ઓળખ તેમજ તેના ઉપયાર માટેની તાલીમ આપવી.
- ઓક્ટોબર માસ દરમ્યાન પેકલોબ્યુટ્રાજોલ ૨૦ ગ્રામ/જાડ કૂલની વિકૃતિમાં ઘટાડો કરે છે.

#### અવલોકન પદ્ધતિ :

આંબાવાડીયામાં કુલ જાડ અને રોગિષ્ટ જાડની સંખ્યા નીચેના કોઠામાં દર્શાવી સરેરાશ રોગના ટકા કાઢવા. આવા શક્ય હોય એટલા પ્લોટ/ફિલ્ડના અવલોકનો લેવા.

#### અવલોકન નોંધવાનો કોઠો :

આંબાવાડી	કુલ જાડની સંખ્યા	રોગિષ્ટ જાડની સંખ્યા	રોગના ટકા
(૧)			
(૧૦)			
કુલ			
સરેરાશ રોગના ટકા			

## ૪. આંબાનું અવરોધ મૃત્યુ (ડાયબેક)

વ્યાધિજન : *Botryodiplodia theobromae* (બોટ્રિયોડિપ્લોડિએ થિયોબ્રોમા)

આ રોગ મુખ્યત્વે ગુજરાત, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, હરિયાણા તેમજ તમિલનાડુમાં જોવા મળે છે. આ રોગને પરિણામે ઝડ ઉપરથી નીચે તરફ સુકાતુ જતુ હોવાથી મહત્તમ નુકશાન થાય છે.

### રોગની ઓળખ :

- આ રોગ શરૂઆતની અવસ્થાએ કુમળી ડાળીઓ પર જોવા મળે છે.
- ત્યાર બાદ પરિપક્વ ડાળી પર જોવા મળે છે. રોગની શરૂઆતમાં ડાળીની ફરતે સફેદ રંગનું આવરણ જોવા મળે છે. જે સમય જતા સંપૂર્ણ કાળો રંગ ધારણ કરે છે.
- ડાળીઓના જોડાણના ભાગે વધુ સ્પષ્ટ રીતે આ રોગના ચિંહો જોવા મળે છે.
- રોગની વધુ તીવ્રતાથી ઝડની કુમળી ડાળીઓ કાળી થઈને સુકાઈ જાય છે.
- રોગિષ્ટ ડાળીઓને ફાડતા વચ્ચેના ભાગમાં બદામી રંગના પટ્ટા જોવા મળે છે.
- ડાળીઓ સુકાતા પહેલા તેમના પર ફાટ જોવા મળે છે. જેમાંથી ગુંદર બહાર નીકળતો દેખાય છે.
- આ રોગને પરિણામે વૃક્ષને આગથી સણગાવી દીઘુ હોય તેવું દેખાય છે.
- આ વ્યાધિન ધણી વખત પાનનો સુકારો પણ કરે છે. જેમા પાન કાળાશ પડતા થઈ સુકાઈ ને ખરી પડે છે.
- આ રોગ ખાસ કરીને નર્સરીમાં વધારે દેખાય છે.
- નર્સરીમાં રોપા સુકાઈ જાય છે અને ધણીવાર પાકી કેરી કાળી પડી સરી જાય છે. આમ આ રોગ પાન અને ફળ પર પણ આવે છે.

### સાનુકૂળ પરિબળો :

- ભારે વરસાદ, ગરમ અને જેજવાળું વાતાવરણ.
- જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમ્યાન આ રોગનો ફેલાવો ઝડપથી થાય છે.
- જમીનનું સખત પણું, ભાસ્મીક જમીન અને ઓછી નિતારશક્તિ ધરાવતી જમીનોમાં આ રોગનું પ્રમાણ વધારે દેખાય છે.

### નિયંત્રણ :

- કલમો બનાવવા માટે તંદુરસ્ત માતૃછોડ/ડાળીઓનો ઉપયોગ કરવો.
- ગ્રાફિટંગ /બડિંગ માટે વપરતા ચાપુને વાપરતા પહેલા જંતુરહિત કરવા.

- નવી તૈયાર કરેલ કલમોને શરૂઆતમાં સૂક્ષ્મ વાતાવરણમાં રાખી ધીમે ધીમે સુર્યપ્રકાશમાં લાવવી.
- નર્સરીમાં જરૂર પડેતો કોર્બેન્ડાજીમ ૫૦ % વે. પા, ૫ ગ્રા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
- આંબાની સૂક્ષ્મ ડાળીઓ કાપી બોર્ડો પેસ્ટ લગાડવો (૧ કિ. ગ્રા મોરથુથ + ૧ કિ. ગ્રા કળી ચૂનો + ૧૦ લિટર પાણી) અથવા બોર્ડો મિશ્રણ ૧ % (મોરથુથ ૧૦૦ ગ્રામ + કળીચૂનો ૧૦૦ ગ્રામ + ૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો.
- રોગિષ્ટ ડાળીઓને નીચેના ૭ સે. મી. ભાગ રહેવા દર્ઢ બાકીના ભાગને કાપી એકત્રિત કરી બાળીને નાશ કરવો અને ત્યારબાદ કાર્બેન્ડાજીમ ૫૦% વે.પા, ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

#### **૫. આંબાની કાળી ડાળીનો રોગ (બ્લેક સ્ટેમ / બ્લેક બેન્ડેડ ડીસીસ)**

**વ્યાવિજન :** *Rhinocladium corticum* (રાઈનોકલેડીયમ કોર્ટિકમ)

##### **રોગની ઓળખ :**

- આ રોગ ખાસ કરીને ૧૦ થી ૨૦ વર્ષના ઝડમાં વધારે દેખાય છે.
- શરૂઆતમાં ડાળી પર કાળા ડાઘા પડે છે. જે સમય જતા મોટા બને છે અને ડાળી પર કાળા પણ જેવું દેખાય છે.
- રોગ નાની પાતળી ડાળીથી માંડી મોટી જાડી ડાળીમાં પણ લાગે છે.
- રોગની કાળજી ન લેવામાં આવે તો ઝડની બધી ડાળીઓમાં અને આંબાવાડીયાના બધા ઝડોમાં રોગ ફેલાય છે જેને પરિણામે ઝડ ધીરે ધીરે નબળું અને બિન ફળાઉ બનતું જાય છે.

##### **સાનુકૂળ પરિબળો :**

- આ રોગ ભેજમય હવામાનમાં વધારે ફેલાય છે.

##### **નિયંત્રણ :**

- રોગિષ્ટ ભાગો અને ડાળીઓની છંટણી કરી તેનો નાશ કરવો.
- રોગિષ્ટ નાના ડાળ વીણી એકઠા કરી બાળીને તેનો નાશ કરવો.
- રોગની શરૂઆતમાં ડાળી નો રોગ વાળો ભાગ છોલીને દુર કરવો અને તેની પર બોર્ડોપેસ્ટ (૧૦ %) લાગાડવી.

## ૬. શ્યામ છારો (સ્યૂટી મોલ્ડ)

વ્યાવિજન : *Capnodium mangiferae* (કેપનોડિયમ મેન્જીફેરી)

રોગની ઓળખ :

- આ રોગ ફૂગથી થાય છે.
- મહિયાનો ઉપદ્રવ વધુ હોય ત્યાં સામાન્ય રીતે જોવા મળે છે કારણ કે આ જીવાતોના શરીરમાંથી એક પ્રકારનું ચીકણું અને ગળ્યુ પ્રવાહી નીકળે છે જે જાડની ડાળીઓ તેમજ પાન પર પડતું હોવાથી આવા જાડની ડાળીઓ અને પાન ગુંદરિયા પ્રવાહીથી છવાઈ જાય છે.
- પાછળથી આ પાન અને ડાળીઓ પર કાળા રંગની ફૂગ છૂટી છવાઈ ઉંગી નીકળે છે અને ધીમે ધીમે પાન પર કાળું અને મખમલી આવરણ બને છે. તેથી આ રોગને શ્યામછારો કહેવામાં આવે છે.
- ફૂગના આવરણને પરિણામે પાનની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ખોરાક બનાવવામાં અવરોધ પેદા થાય છે જેને પરિણામે જાડની વૃદ્ધિ તેમજ વિકાસ ઉપર માઠી અસર થતી જોવા મળે છે.
- ફૂલ બેસવાની અવસ્થા દરમ્યાન આ રોગને પરિણામે ફળો બેસતા નથી તેમજ કયારેક ખરી પડે છે. કેરી ઉતાર્યા બાદ તેના પર કાળા આવરણને લીધે કેરીની ગુણવત્તા બગડે છે અને કિંમત ઓછી ઉપજે છે.

અસર કરતા પરિબળો :

- સતત ભારે વરસાદને પરિણામે આ ફૂગ ધોવાઈ જાય છે પરંતુ વાતાવરણમાં વધુ પડતો ભેજ રોગમાં વધારો કરે છે.
- જુના અને ગીય આંબાવાડિયામાં પ્રકાશની તીવ્રતા ઓછી હોવાથી આ રોગ વધુ જોવા મળે છે.
- આંબાવાડિયામાં વચ્ચેના ભાગમાં રહેલ જાડોમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

નિયંત્રણ :

- આ રોગ માટે મુખ્યત્વે આંબાના મહિયા જવાખદાર હોવાથી યોગ્ય કીટનાશક દવાઓનો ઉપયોગ કરવો.
- મેન્કોઝેબ ૨ ગ્રામ/લિટર અથવા કાર્બેન્ડાઝીમ ૦.૫ ગ્રામ/લિટરનો છંટકાવ કરવો.
- પાકની પાછલી અવસ્થાએ સાંચા પાણીનો છંટકાવ કરી જાડને નવડાવી દેવું અથવા સ્ટાર્ચનું દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી સારુ પરિણામ મળે છે.

## ૭. પાનનો ભૂખરો ઝાળ

વ્યાવિજન : *Pestalotia mangiferae* (પેસ્ટાલોસિયા મેન્જીફેરી)

### રોગની ઓળખ :

- આ રોગમાં પાનની ધાર ઉપર જાંખા બદામી રંગના ખૂણા પડતા ટપકાં જોવા મળે છે જેની કિનારી ઘાંટા બદામી રંગની હોય છે.
- જખમો ભેગા થતા ધાબા ઘાંટા રાખોડી રંગનાં બને છે.
- આખું પાન રોગગ્રસ્ત થવાથી સુકાઈ જઈ ખરી પડે છે.

### સાનુકૂળ પબિચણો :

- મધ્યમ તાપમાન અને વરસાદ વાળું વાતાવરણ આ રોગને વધુ માફક આવે છે.

### નિયંત્રણ :

- કાલવ્રણ તેમજ ભૂકીછારાના નિયંત્રણ માટેના પગલા આ રોગને કાબૂમાં રાખવા માટે મદદરૂપ થાય છે.
- મેન્કોઝેબ ૭૫% વે. પા, ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

અથવા

કાર્બન્ડેઝીમ ૫૦% વે. પા., ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

## ૮. પાનની ટોચનો ઝાળ (લીફ ટીપ બ્લાઈટ)

આ રોગ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ખૂબજ અગત્યનો રોગ છે. ખાસ કરીને કાંઠાં વિસ્તારની વાડીઓમાં સૌથી વધારે નુકશાન કરે છે. આ રોગ નાની કલમોથી માંડી મોટા જાડ પર પણ લાગે છે. રોગની તીવ્રતા વધારે હોય તો જાડ નબળું રહે છે અને ઉત્પાદન સારુ મળતું નથી.

વ્યાવિજન : *Phylosticta mangiferae* (ફાયલોસ્ટિક્ટા મેન્જીફેરી) નામની કુગથી આ રોગ થાય છે

### રોગની ઓળખ :

- આ રોગ ખાસ કરીને પરિપક્વ પાનમાં આવે છે.
- કુમળા પાનપર આ રોગ જોવા મળતો નથી. રોગની શરૂઆત પાનની ટોચથી થાય છે.
- જેમા ટોચ બદામી રંગની થઈ સૂકાય જાય છે ત્યારબાદ રોગ પાનની બને ધાર પર આગળ વધે છે અને વચ્ચેનો ભાગ લીલો રહે છે જેથી અંગ્રેજી ઉધો 'વી' આકાર જેવું લાગે છે.
- રોગની તીવ્રતા વધુ હોય તો આખા પાન સૂકાઈ જાય છે અને ખરી પડે છે.

### સાનુકૂળ પરિબળો :

- આ રોગ ખાસ કરીને ભેજમય વાતાવરણમાં વધારે થાય છે.
- ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ પવનોને લીધે તેનું પ્રમાણ વધારે દેખાય છે.
- આ ઉપરાંત ઝડનો પશ્વિમ દિશાનો ભાગ વધારે રોગગ્રસ્ત થાય છે.

#### **નિયંત્રણ :**

- આ રોગનું નિયંત્રણ કાલવ્રણ રોગના નિયંત્રણ મુજબ પગલા લેવાથી કરી શકાય છે.

#### **૮. તામ્ ગેરુ (રેડ રસ્ટ)**

**વ્યાવિજન :** *Cephaleuros virescens* (સેફેલેરસ વિરેસેન્સ )

#### **રોગની ઓળખ :**

- આ રોગની શરૂઆતમાં પાન ઉપર પાણી પોચા ટપકા જોવા મળે છે.
- જે તારા આકારના સફેદ ટપકામાં પરિણામે છે.
- સમય જતા લાલ નારંગી રંગ ધારણ કરે છે અને અંતે સફેદ કે રાખોડી હાથ તરીકે રહે છે.
- કેટલીક વાર આવા ટપકાં વર્ચ્યેનો ભાગ ખરી જતા છીદ્ર જણાય છે.
- ઘણી વખત ડાળીઓ અને ફળ પર ટપકાં જોવા મળે છે.
- રોગની તીવ્રતા વધારે હોય તો આવું રોગગ્રસ્ત ઝડ નબળું રહે છે અને તેનું ઉત્પાદન ઘટે છે.

#### **સાનુક્કુણ પરિબળો :**

- આ રોગ મુખ્યત્વે વરસાદના પાણીથી ફેલાય છે.
- રોગને ભેજમય વાતાવરણ વધુ માફક આવે છે.

#### **નિયંત્રણ :**

- નવા આંબાવાડીયામાં બે ઝડ વર્ચ્યે યોગ્ય અંતર રાખવું.
- અપૂરતા પોષણને લીધે કૂગની તીવ્રતા વધતી હોવાથી યોગ્ય પ્રમાણમાં ખાતર અને પિયત આપવું.
- મેન્કોઝેબ ૭૫% વે. પા., ૨૫ ગ્રામ અથવા કાર્બોન્ડાજીમ ૫૦% વે. પા., ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. રોગિએ ખરેલા પાન વીણી તેનો બાળીને નાશકરવો.

આંબાવાડીમાં આવતા રોગોનો સમય ને ધ્યાનમાં રાખી દક્ષિણ ગુજરાતની હવામાનને ધ્યાનમાં રાખી આ વિભાગ દ્વારા એક પાકસરંક્ષણ સૂચિપત્રક તૈયાર કરવામાં આવેલ છે. જેમાં જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરવામાં આવેતો આંબાવાડી તંદુરસ્ત રહે છે.

### આંબાવાડીયામાં પાક સંરક્ષણ સૂચિ પત્રક

અ. નં.	ઇંટકાવનો સમય અને રોગ	કૂગનાશક દવાનું નામ	૨૦૦ લીટર પાણીમાં દવાનો જથ્થો
૧	ઓક્ટોબર અંત અથવા નવેમ્બર (બધા રોગો)	કોપરઓક્સિક્લોરાઈડ ૫૦% અથવા બોર્ડો મિશ્રણ ૦.૮%	૮૦૦ ગ્રામ અથવા ૧૬૦૦ ગ્રામ મોરથુથુ + ૧૬૦૦ ગ્રામ ચૂનો
૨	નવેમ્બર અંત (પાનનો ઝાળ તેમજ કાલવ્રાણ)	કાર્બન્ડેજીમ ૫૦% વે. પા.	૧૦૦ ગ્રામ
૩	ડીસેમ્બર મોરની દુંખ નીકળે ત્યારે (ભૂકી છારો)	વેટેબલ સલ્ફર ૮૦%	૫૦૦ ગ્રામ
૪	જાન્યુઆરી મોર નીકળે અને કળી બંધાય ત્યારે	ડીનોકેપ ૪૮% અથવા ટ્રાયડેમોઇ ૮૦%	૨૦૦ મીલી ૧૦૦ મીલી
૫	ફેબ્રુઆરી વટાણા જેવડા કદના મરવા થાય ત્યારે (ભૂકી છારો તેમજ અન્ય રોગો)	કાર્બન્ડેજીમ ૫૦% વે. પા અથવા થાયોફેનેટ મીથાઈલ ૭૦%	૧૦૦ ગ્રામ ૧૦૦ ગ્રામ
૬	માર્ચ લખોટા જેવડા મરવા થાય ત્યારે (ભૂકી છારો તેમજ અન્ય રોગો)	ડીનોકેપ ૪૮% અથવા ટ્રાયડેમોઇ ૮૦%	૨૦૦ મીલી ૧૦૦ મીલી
૭	એપ્રિલ કેરીમાં ગોટલી બંધાવાની શરૂઆત થાય ત્યારે (અન્થોકનોઝ, ડાયબેક ફણના સડા વિગરે રોગો)	કાર્બન્ડેજીમ ૫૦% અથવા મેન્કોઝેબ ૮૦%	૪૦૦ ગ્રામ ૪૦૦ ગ્રામ

### ૧૦. આંબાનો વાંદો (લોરેન્થસ)

- આંબાની ડાળી ઉપર આંબા કરતા જુદા પ્રકારના પાન વાળા છોડ ઉગી નીકળે છે.
- જે એક પરોપજીવી વનસ્પતિ છે જે આંબામાંથી પોતાનું શોષણ મેળવે છે. આ છોડના ડાળી સાથેના જોડાણા આગળ ગાંઠ બનેલ હોય છે.
- આ છોડ પર નાના બોર જેવા ફળ આવે છે. જે ખાવામાં મીઠા હોયછે.
- પક્ષીઓ આ ફળ ખાય છે અને ચાંચ અને મળ દ્રારા વાંદાનો ફેલાવો કરે છે.

## નિયંત્રણ :

- આ રોગના અસરકારક નિયંત્રણ માટે ગાંઠ સુધીના વાંદા વાળી ડાખી કાપી લેવી અને કપાયેલા ભાગો ઉપર બોર્ડોપેસ્ટ અથવા ડામર લગાડવો.

## મોજણી અને નિગાહ આધારીત પાક જીવાત રોગ પૂર્વનુમાન પદ્ધતિ ડેટા ઉપયોગમાં લેવાયેલ કોડ નંબરની વિગત:

૧. કેન્દ્ર કોડ નંબર			
સંશોધન કેન્દ્રો	કોડ નંબર	સંશોધન કેન્દ્રો	કોડ નંબર
તાણાંદી	૦૧	નવસારી (NARP)	૧૧
ભરૂચ(કપાસ)	૦૨	નવસારી (કઠોળ)	૧૨
ભરૂચ(NARP )	૦૩	નવસારી (શેરડી)	૧૩
અછાલીયા	૦૪	ગણાદેવી	૧૪
હાંસોટ	૦૫	પરીયા	૧૫
સુરત (કપાસ)	૦૬	વધઈ	૧૬
સુરત (જૃવાર)	૦૭	વણારસી	૧૭
બારડોલી	૦૮	નવસારી (WM)	૧૮
વારા	૦૯	અસ્પી સંશોધન ફર્મ નવસારી	૧૯
દાંતી	૧૦		
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર	કોડ નંબર	કૃષિ વિજ્ઞાન કેન્દ્ર	કોડ નંબર
વધઈ	૨૦	નવસારી	૨૨
વારા	૨૧	ડેડીયાપાડા	૨૩
કૃષિ ડિપ્લોમા / પોલીટેકનીક	કોડ નંબર	કૃષિ ડિપ્લોમા / પોલીટેકનીક	કોડ નંબર
નવસારી	૨૪	ભરૂચ	૨૫
વારા	૨૫	વધઈ	૨૭
૨. તાલુકા કોડ			
ભરૂચ જીલ્લો (૧)			
તાલુકા કોડ	કોડ નંબર	તાલુકા કોડ	કોડ નંબર
આમોદ	૦૧	ભરૂચ	૦૫
અંકલેશ્વર	૦૨	વાગરા	૦૬
જંબુસર	૦૩	વાલીયા	૦૭
જઘડીયા	૦૪	હાંસોટ	૦૮
નર્મદા જીલ્લો (૨)			
તાલુકા કોડ	કોડ નંબર	તાલુકા કોડ	કોડ નંબર
નાંદોદ	૦૧	ડેડીયાપાડા	૦૩
સાગબારા	૦૨	તિલકવાડા	૦૪

### સુરત જીલ્લો (૩)

તાલુકા કોડ	કોડ નંબર	તાલુકા કોડ	કોડ નંબર
ઓલપાડ	૦૧	મહુવા	૦૬
કામરેજ	૦૨	માંગરોળ	૦૭
ચોરાસી	૦૩	માંડવી	૦૮
પલસાણા	૦૪	સુરત (સીટી)	૦૯
બારડોલી	૦૫	ઉમરપાડા	૧૦

### તાપી જીલ્લો (૪)

તાલુકા કોડ	કોડ નંબર	તાલુકા કોડ	કોડ નંબર
નિઝર	૦૧	વારા	૦૩
વાલોડ	૦૨	સોનગઢ	૦૪
ઉચ્છલ	૦૫		

### વલસાડ જીલ્લો (૫)

તાલુકા કોડ	કોડ નંબર	તાલુકા કોડ	કોડ નંબર
ઉમરગામ	૦૧	કપરાડા	૦૪
ધરમપુર	૦૨	વલસાડ	૦૫
પારડી	૦૩		

### નવસારી જીલ્લો (૬)

તાલુકા કોડ	કોડ નંબર	તાલુકા કોડ	કોડ નંબર
વાંસદા	૦૧	નવસારી	૦૪
ચીખલી	૦૨	જલાલપોર	૦૫
ગણદેવી	૦૩		

### ડાંગ જીલ્લો (૭)

તાલુકા કોડ	કોડ નંબર		
આહવા	૦૧		

### ૩. જીલ્લા કોડ નંબર

જીલ્લો	કોડ નંબર	જીલ્લો	કોડ નંબર
ભરૂચ	૧	વલસાડ	૫
નર્મદા	૨	નવસારી	૬
સુરત	૩	ડાંગ	૭
તાપી	૪		

### ૪. પાક કોડ નંબર

પાકનું નામ	કોડ નંબર	પાકનું નામ	કોડ નંબર
આંખા	૧૫	ચીકુ	૧૬

### ૫. વેરાયટી / જાત કોડ નંબર

### આંખો (૧૫)

જાત	કોડ નંબર	જાત	કોડ નંબર
આંકુસ	૦૧	નિલેસાન	૦૭

કેસર	૦૨	નિલક્ષણસો	૦૮
રાજાપુરી	૦૩	જમાદાર	૦૯
તોતાપુરી	૦૪	દાડમીયો	૧૦
નિલમ	૦૫	પાયરી	૧૧
નિલેશ્વરી	૦૬	દશેરી	૧૨

### ચીકુ (૧૬)

જાત	કોડ નંબર	જાત	કોડ નંબર
કાલીપત્તી	૦૧	છિક્કેટ બોલ	૦૨
કલકૃતી	૦૩	અન્ય	૦૪

૬ જીવાત કોડ નંબર અને ક્ષમ્યમાત્રા :

### આંબા (૧૫)

જીવાતનું નામ	કોડ નંબર	ક્ષમ્યમાત્રા
મધીયો	૨૫	૫ બચ્ચાં / પુખ્ત / કુંપળ દીઠ
શ્રીપસ	૨૬	૧૦ બચ્ચાં અને પુખ્ત / પ્રશાખા
ફળમાખી	૨૭	ફળમાખીની હાજરી

### ચીકુ (૧૬)

જીવાતનું નામ	કોડ નંબર	ક્ષમ્યમાત્રા
ચીકુ બડ બોરર	૨૮	૧૦ % ઉપદ્વિત કળીઓ
ચીકુ મોથ	૨૯	૧૦ % ઉપદ્વિત પાન
લીફ ફોલ્ડર / લીફ માઈનોર	૩૦	૧૦ % ઉપદ્વિત પાન
ચીકુ સીડ બોરર	૩૧	૩ % ઉપદ્વિત ફળ
ફળમાખી	૨૭	ફળમાખીની હાજરી

### રોગનો કોડ નંબર

### આંબા (૧૫)

રોગનું નામ	કોડ નંબર	રોગનું નામ	કોડ નંબર
ભૂકી છારો	૨૮	કાલવ્રણ	૨૯
વિકૃતી (માલશોર્મેશન)	૩૦		

### ચીકુ (૧૬)

રોગનું નામ	કોડ નંબર	રોગનું નામ	કોડ નંબર
પાનના ટપકાં	૩૧	સુકારો	૩૨

## Mango (15) (Entomology)

Observation time:

Variety code:

Date:

Centre	Taluka	Dist.	Std. week	Temp		Humidity %	Rain mm Days	
				Max.	Min.			

No. of tree	Mango Hopper (25) No. of Nymph/adults/shoots										Total	Remarks
	1	2	3	4	5	6	7	8	9	10		
1												
2												
3												
4												
5												
6												
7												
8												
9												
10												
<b>AVERAGE</b>												----

ETL: Mango Hopper: 5 Nymph/adult/shoot

No. of tree	Mango Thrips (26) No. of Nymph/adults/shoots										Total	Remarks
	1	2	3	4	5	6	7	8	9	10		
1												
2												
3												
4												
5												
6												
7												
8												
9												
10												
<b>AVERAGE</b>												----

ETL: Thrips: 10 Nymph/adult/shoot

## Mango (15) (Entomology)

Trap No.	Fruit fly (27) No. of fruit fly observed in trap before replacing cotton swab dipped in Methyl eugenol	No. of fruit fly observed after one hour of placing new cotton swab dipped in Methyl eugenol	Remarks
1.			
2.			
3.			
Total			

ETL:

Mango fruit fly: Presence of fruit fly

Observation on mango stem borer, mealy bug, shoot borer, gall midge, red ant should also be recorded as per the following method.

1. Mango stem borer - Percentage incidence in mango orchard
2. Mango mealy bug- Presence of the pest
3. Shoot borer- Per cent incidence
4. Gall midge- Percentage leaf damage
5. Red ant - Presence of the pest

### Mango (15) (Plant )Pathology

Observation time: Throughout the year

Variety code:

Date:

Centre	Taluka	Dist.	Std. week	Temp		Humidity %	Situation of Sky	Rain mm	Rain Days
				Max.	Min.				

### Powdery Mildew (28)

Tree No.	Ratings (10 inflorescences)									
	1	2	3	4	5	6	7	8	9	10
1.										
2.										
3.										
4.										
5.										
6.										
7.										
8.										
9.										
10.										

**Grand Total of 100 inflorescences**

**PDI:**

Disease Rating	Infested area
0	No disease
1	1-20 % area infected. (About 1-10 spots on branch of flower)
2	21-40 % area infected (About 11-20 spots on branch of flower)
3	41-60 % area infected (About 20-40 spots on branch of flower)
4	61-80 % area infected (About 2/3 part of flowering branch infected)
5	81-100 % area infected, (About 3/4 part of flowering branch infected, flowers dried)

#### Σ of Rating of infected inflorescence

$$\text{PDI} = \frac{\text{No. of inflorescence observed (100)} \times \text{maximum disease score (5)}}{100} \times 100$$

$$\text{No. of inflorescence observed (100)} \times \text{maximum disease score (5)}$$

**Mango (15) (Plant )Pathology**  
**Anthracnose (29)**

Tree No.	Ratings (10 inflorescences)									
	1	2	3	4	5	6	7	8	9	10
1.										
2.										
3.										
4.										
5.										
6.										
7.										
8.										
9.										
10.										
<b>Grand Total of 100 inflorescences</b>										
<b>PDI:</b>										

Disease Rating	Infested area
0	No disease
1	1 % area infected.
2	1.1-10 % area infected
3	10.1- 25 % area infected
4	25.1-50 % area infected
5	Above 50 %

$$\text{PDI} = \frac{\Sigma \text{ of Rating of infected inflorescence}}{\text{No. of inflorescence} \times \text{maximum observed (100)}} \times 100$$

disease score (5)

**Malformation (30)**

No. of Mango Orchards	Total no. of tree	Infected tree	Per cent disease incidence
1.			
2.			
3.			
4.			
5.			
Total			
	Overall Per cent disease incidence		

**Sapota (16) (Entomology)**

Observation time: Throughout the year

Variety code:

Date:

Centre		Taluka		Dist.	Std. week		Temp		Humidity %	Rain		
							Max.	Min.		mm	Days	
No. of tree	Chicku bud borer (28)											
	No. of branches											
	1		2		3		4		5		Total	
	1	Total No. of buds	Total No. of Infested buds	Total No. of buds	Total No. of Infested buds	Total No. of buds	Total No. of Infested buds	Total No. of buds	Total No. of Infested buds	Total No. of buds	Total No. of Infested buds	
	2											
	3											
	4											
	5											
	6											
	7											
Total												
Per cent bud damage												

ETL: 10 % damaged buds

No. of tree	Chicku Moth (29) No. of damaged leaves/top 10 leaves					Total	Remarks
	No. of branches	1	2	3	4	5	
1	→						
2							
3							
4							
5							
6							
7							
8							
9							
10							
Grand Total							---
Per cent leaf damage							

ETL: 20 % infested leaves

No. of tree	Chiku Leaf folder/leaf miner(30) No. of damaged leaves/top 10 leaves					Total	Remarks
	1	2	3	4	5		
No. of branches	1	2	3	4	5		
1							
2							
3							
4							
5							
6							
7							
8							
9							
10							
Grand Total							----
Per cent leaf damage							

ETL: 10 % infested leaves

Chiku seed borer,

No. of tree	Chiku seed borer (38)											
	No. of branches											
	1		2		3		4		5		Total	
1	Total No. of fruits	Total No. of Infested fruits	Total No. of fruits	Total No. of Infested fruits	Total No. of fruits	Total No. of Infested fruits	Total No. of fruits	Total No. of Infested fruits	Total No. of fruits	Total No. of Infested fruits	Total No. of fruits	Total No. of Infested fruits
2												
3												
4												
5												
6												
7												
8												
9												
10												
Total												
Per cent fruit damage												

ETL: 3 % damaged fruits

## Sapota (16) (Entomology)

Trap No.	Fruit fly (27) No. of fruit fly observed in trap before replacing cotton swab dipped in Methyl eugenol	No. of fruit fly observed after one hour of placing new cotton swab dipped in Methyl eugenol	Remarks
4.			
5.			
6.			
Total			

## ETL:

## Mango fruit fly: Presence of fruit fly

Observations on semilooper, hairy caterpillar, midrib folder should also be recorded as per the following method.

1. Semilooper - Per cent leaf damage
  2. Hairy caterpillar - Per cent leaf damage
  3. Midrib folder - Per cent leaf damage

**Sapota (16) (Plant Pathology)**

**Observation time:** Throughout the year

## Variety code:

Date:

## **Leaf spot (31)**

Disease Rating	Infested area
0	No disease
1	1 % area infected.
2	1.1-10 % area infected
3	10.1- 25 % area infected
4	25.1-50 % area infected
5	Above 50 %

PDI = 
$$\frac{\Sigma \text{ of Rating of infected twigs}}{\text{No. of leaves observed (300)} \times \text{maximum disease score (5)}} \times 100$$

### Sapota (16) (Plant Pathology)

#### Wilt (32)

No. of Sapota Orchards	Total no. of tree	Infected tree	Per cent disease incidence
6.			
7.			
8.			
9.			
10.			
Total			
	Overall Per cent disease incidence		




૪.૨ આંબાનું અવરોહણ મૃત્યુ (ડાયબેક)



૨.૧ ચીકુનો સુકારો (વીલ્ટ)



3.१ फलमाखीनुं  
नर अने मादा कीटक



ईंडा मुकवाने कारणो  
थयेल नुकशान



3.२ केरीना फलमां फलमाखीनुं नुकशान



3.३ फलमाखीनो कीटो



3.४ नर फलमाखीने आकर्षवा माटेनुं भिथाईल युज्जनोल बरणी अने खोभा ट्रैप

